

Super Visa/ Visitor to Canada Insurance

Best Mortgage Rates
1st and 2nd Mortgages
Life and Critical Illness Insurance
RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
Serving at 2 locations
GTA East / GTA West
Investment | Insurance | Mortgages

परदेशां देशनी महेंक अटले

स्वदेश

केनेडाथी प्रसिद्ध थतुं सर्वोत्तम गुजराती साप्ताहिक SWADESH

हरिप्रसाद स्वामीजी ब्रह्मलीन :
1 ओगस्टे अंतिम क्रिया

PAGE NO. 12

FRIDAY, 30 JULY, 2021 Vol. 18, No. 31 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

8.2ની तीવ્રતાના ભૂકંપથી અલાસ્કા ધ્રુજ્યું

ભૂકંપનું એપી સેન્ટર પેરીવિલથી 91 કિ.મી દૂર ધરતીના પેટાળમાં નોંધાયું, હવાઈમાં સુનામીના ભયથી એલર્ટ



પેરીવિલ

અમેરિકાના અલાસ્કામાં બુધવારે રાત્રે શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. અમેરિકન જિયોલોજિકલ સર્વેના કહેવા પ્રમાણે ભૂકંપની તીવ્રતા ૮.૨ રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. આ શક્તિશાળી ભૂકંપ પછી હવાઈમાં સુનામીનો ભય હોવાથી એલર્ટ જારી કરાયો હતો અને લોકોને સલામત સ્થળે ખસેડવાની સલાહ અપાઈ હતી.

અલાસ્કામાં ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા ૮.૨ નોંધાઈ હતી. એક વખત ભૂકંપ ત્રાટક્યો તે પછી થોડીક મિનિટોમાં ૬.૨ અને ૫.૬ના ઝટકા પણ અનુભવાયા હતા. જોકે, આ ભૂકંપથી જાનહાનિ થયાના અહેવાલો ન હતા. ભૂકંપનું એપી સેન્ટર પેરીવિલ શહેરથી ૯૧ કિલોમીટર દૂર ધરતીના પેટાળમાં નોંધાયું હતું.

સત્તાવાર આંકડા પ્રમાણે અલાસ્કામાં છેલ્લાં ૭૫ વર્ષમાં ચોથી વખત ૮ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. ધરતીના પેટાળમાં ભારે હલચલ થઈ રહી હોવાની ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં, ઉપરા-ઉપરી ત્રણ વખત ભૂકંપ આવ્યો તે પછી અમેરિકાના જિયોલોજિકલ સર્વેના અધિકારીઓએ હવાઈ ટાપુમાં સુનામી ત્રાટકવાની દહેશત વ્યક્ત કરી હતી. અગાઉ ૧૯૬૫માં અલાસ્કામાં ૮.૭ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો પછી સમુદ્રના

મોજાં ૧૦.૭ મીટર સુધી ઊંચા નોંધાયા હતા. અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે કાંઠા વિસ્તારમાં સુનામીની શક્યતા વ્યક્ત કરી તે પછી હવાઈ, ગુઆમ અને અમેરિકન સામોઆમાં નિયાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચાઈએ સ્થિત સરકારી આશ્રયગૃહોમાં જતા રહેવાની ચેતવણી અપાઈ હતી.

દરમિયાન મ્યાંમારમાં ભૂકંપનો ઝટકો આવ્યો હતો. મ્યાંમારમાં ૫.૫ રિક્ટર સ્કેલનો ભૂકંપ ત્રાટક્યો હતો, તેની અસર થાઈલેન્ડ સુધી થઈ હતી. મ્યાંમારની ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર બિંદુ ૧૦ કિલોમીટર પૃથ્વીના પેટાળમાં નોંધાયું હતું. આ ભૂકંપના કારણે જાનહાનિ થઈ ન હતી, પરંતુ જૂની ઈમારતોમાં નુકસાન થયું હતું અને એવી ઈમારતોમાં રહેતાં ઘણાં લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલો હતા. મ્યાંમાર સેસ્મિક ફોલ્ટ લાઈનમાં હોવાથી ત્યાં અવારનવાર ભૂકંપ ત્રાટકે છે. છેલ્લે મે માસમાં આવેલા ભૂકંપમાં ત્રણ લોકોનાં મોત થયા હતા અને ૨૪થી વધુને ઈજા થઈ હતી.

પેગાસસ જાસૂસી કેસ

CJI રમત્રાને 500 લોકોએ પત્ર લખી હસ્તક્ષેપની માંગણી કરી

નવી દિલ્હી

પેગાસસ જાસૂસી કેસ અંગેનો વિવાદ હજી સમાપ્ત થાય તેવું લાગતું નથી. હવે દેશનાં 500 થી વધુ લોકો અને સંગઠનોએ સપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને આ મામલામાં દખલ કરવાની વિનંતી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 500 થી વધુ લોકો અને ગૃપોએ CJI એન વી રમત્રાને ઈઝારાયેલી કંપની NSO પાસેથી પેગાસસ સ્પાયવેરની ખરીદીને તાત્કાલિક બંધ કરવાની વિનંતી કરી છે.

CJI ને લખેલા પત્રમાં, પેગાસસ સ્પાયવેરના ઉપયોગ અંગે વિવિધ મીડિયા રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. CJIને પત્ર લખનારાઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ વિપક્ષનાં નેતાઓ શિક્ષણવિદો, પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ, વકીલો વિદ્યાર્થીઓ, અને



જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની જાસૂસી કરવા માટે કરવામાં આવી રહ્યો હતો.

પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતની તપાસ કરે કે શું કોઈ ભારતીય સંસ્થા કે કંપનીએ પેગાસસ ખરીદ્યું હતું. અને જો હા, તો તે માટે ચૂકવણી કેવી રીતે કરવામાં આવી? તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. પત્ર લખનારાઓમાં અરુણા રાય, હર્ષ મંદર, અંજલી ભારદ્વાજ, વૃંદા ગ્રોવર, રોમિલા થાપર, લેખિકા અરુંધતી રાય, અનુરાધા ભસીન વગેરેનો સમાવેશ થાય છે.

SUPER VISA & INSURANCE

Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

ઈન્ડોનેશિયામાં ડેલ્ટા વેરિઅન્ટથી 800 બાળકોના મોત

PAGE NO. 18

ABOWATH
REAL ESTATE GROUP

MAAZ ABOWATH
BROKER
416 899 4585
More Info on PAGE 2
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપનો અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Residential
New Condos
Investments
Commercial

દુસામાં યાદ રાખરો

Zakir Patel
Broker

Cell: 416-561-7973
Office: 416-287-2222

RE/MAX
COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: pafelzakir82@gmail.com

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002



વેક્સીનેશન છતાં અલ્બર્ટામાં ચોથી લહેરની સંભાવના

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૩૩૪, ૮૪ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ : પ્રતિબંધો હળવા થતાં સંક્રમણનો ભય વધ્યો

ટોરોન્ટો : અલ્બર્ટામાં કોવિડ-૧૯ની પ્રસાર ક્ષમતા એટલે કે આર વેલ્યુ ઉચ્ચ સ્તરે પહોંચી છે. જો કે દૈનિક કેસની સંખ્યા ઘટી રહી છે. ત્યારે એક સવાલ ઉભો થાય છે કે જો દેશમાં વેક્સીનેશન પુરતું થયું હોય તો આ આર વેલ્યુને જોતા કોવિડ -૧૯ની ચોથી લહેરની સંભાવના કેટલી ?

અલ્બર્ટામાં આર વેલ્યુ લગભગ ૧.૪૮ સુધી ગયા અલ્બર્ટાના અંતે જોવા મળી હતી, જ્યારે ત્રીજા વેવની તીવ્રતા વધુ હતી ત્યારે રોજના ૧૫૦૦ની આસપાસ કેસ નોંધાતા હતા. આ સમયે આર વેલ્યુ લગભગ ૧.૧૫ જેટલી હતી. જો આર વેલ્યુ ૧થી ઓછી હોય તો મહામારી પર નિયંત્રણ આવી ગયું હોય એમ માની શકાય અને

રોગચાળાને નિયંત્રણમાં રાખી શક્યા હોવાનું માની શકાય એમ ચેપી રોગોના નિષ્ણાંત ડો. આઈઝેક બોગોચે કહ્યું હતું.

મીડિયા સાથે બુધવારે ટેલીફોનિક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, આર વેલ્યુને ધ્યાનમાં રાખવામાં આવે તો અત્યારે રોગચાળો નિયંત્રણ હેઠળ ગણાય. અલ્બર્ટાના હેલ્થ વિભાગના અહેવાલ મુજબ બુધવારે કોવિડ-૧૯ના ૧૯૪ નવા કેસ નોંધાયા છે.

જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૩૩૪ છે. જે છેલ્લા કેટલાક અલ્બર્ટામાં સૌથી વધુ છે. હાલમાં ૮૪ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં ૧૮ આઈસીયુમાં છે. બુધવારે આવેલા પહેલા અહેવાલમાં ચીફ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો.ડીના



હિન્શાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં વધેલા કેસ એવા છે જેમાં દર્દીઓ પુરી રીતે વેક્સીનેટેડ નથી.

એવા લોકો બીજાના સંપર્કમાં આવે એટલે મહામારી ફેલાવાની તીવ્રતા વધી

શકે છે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે વેક્સીનેશનને અત્યંત જરૂરી બાબત ગણાવી હતી અને કહ્યું હતું કે, વેક્સીન નહીં લેનારાઓ એનો ભોગ વધુ ઝડપથી બની શકે

છે એ હવે પુરવાર થઈ ચુક્યું છે. યુનિવર્સિટી ઓફ અલ્બર્ટાની સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર અને પૂર્વ ચીફ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો.જેમ્સ ટાલ્બોટે કહ્યું હતું કે, વધતા જતા આંકડા ચિંતાજનક છે. વળી, ડેલ્ટા વેરિયન્ટ વધુ સક્રિય બન્યો છે.

બીજી તરફ સત્તાવાળાઓએ પ્રતિબંધો હળવા કરવાની શરૂઆત પહેલી જુલાઈથી કરી દીધી હોવાથી પણ ચિંતા વધશે. કેનેડા પાસે પુરતા પ્રમાણમાં વેક્સીન છે ત્યારે વેક્સીનેશનની ઝડપ વધારવી જરૂરી બનશે. પૂર્ણ રીતે વેક્સીનેટેડ લોકોનું પ્રમાણ વધશે તો જ મહામારી પર નિયંત્રણ આવી શકશે એમ નિષ્ણાંતો પણ માને છે.

ઓન્ટેરિયોના નર્સિંગ સેક્ટર માટે ચિંતાજનક સંકેતો : અનેક કર્મચારી નોકરી છોડવા તૈયાર

ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કર તરીકે કામ કરવા છતાં તેમની કદર થઈ નહીં

ટોરોન્ટો

ઓન્ટેરિયોની રજીસ્ટર્ડ આઈસીયુ નર્સ બ્રિગીટ ઉમેગા મહામારી દરમિયાન પુરો સમય કામ કરતી રહી હતી. હવે કોવિડ-૧૯ના નવા કેસો ઘટી રહ્યા છે અને વેક્સિનેશન વધી રહ્યું છે. ત્યારે કોઈને એમ લાગે કે, હવે નર્સ રાહતનો શ્વાસ લઈ શકતી હશે પણ બ્રિગીટના કિસ્સામાં એવું નથી.

તેણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હવે અમારું મનોબળ ઘટી ગયું છે, લોકો પણ હતાશ છે. મહામારી દરમિયાન ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કર તરીકે કામ કરવા છતાં તેમની કદર થઈ નથી એટલે હવે કદાચ તે આ કામ છોડી શકે છે. ઓન્ટેરિયોમાં આઈસીયુ નર્સની ભારે તંગી છે. જ્યારે કેટલીય અનુભવી નર્સ પણ વધારે પડતા કામને કારણે કંટાળી ચુકી છે. જેને કારણે તેઓ આ લાઈન છોડવાનું વિચારી રહી છે. વધુ પડતા કામ ઉપરાંત સુવિધાઓની તંગીને કારણે એમની મુશ્કેલીઓ વધી રહી છે. હવે કોઈ વધારાની સુવિધાઓ મળતી નથી. એક અન્ય નર્સ નામ ગુમ રાખવાની શરતે કહ્યું હતું કે એ જે હોસ્પિટલમાં કામ કરે છે ત્યાં સ્ટાફ ઘણો જ ઓછો છે. ગયા અઠવાડિયે જ અમારા આઈસીયુમાં માત્ર બે નર્સ હતી. જે સતત દિવસ રાત



કામ કરતી રહી હતી. વળી, કોઈ રીલીવર ન હોવાથી એ લેબમાં પણ જઈ શકતી નહોતી. રાખેતા મુજબ તો એ યુનિટમાં આઠથી નવ દર્દીઓ વચ્ચે એકના હિસાબે દરેક નર્સ કામ કરવું પડે છે. જેમ જેમ સાથી કર્મચારીઓ નોકરી છોડીને જઈ રહ્યા છે તેમ તેમ સ્થિતિ ગંભીર બનતી જાય છે. અત્યાર સુધી ૧૬ જણા નોકરી છોડી ગયા છે. એપ્રિલ ૨૦૨૦ની સરખામણીમાં એપ્રિલ ૨૦૨૧માં હેલ્થકેર વર્કરોના કામના કલાકો પણ વધ્યા છે. બ્રિગીટ એમ પણ કહ્યું હતું કે, મહામારી દરમિયાન તેણે એક પણ રજા લીધી નહોતી. પણ હવે વધારાના કામથી ત્રાસી ગઈ હતી.

શાળાઓ ફરી શરૂ થાય એ પહેલા વિદ્યાર્થીઓને વેક્સીનેશન જરૂરી

ટોરોન્ટો

શાળાઓ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે કેટલાક ડોક્ટરો વાલીઓને વિનંતી કરી રહ્યા છે કે, તેમના ૧૨થી ૧૭ વર્ષના વિદ્યાર્થી સંતાનોને જલદીથી વેક્સીન અપાવી તેમને સુરક્ષિત કરે. જો વેક્સીનના બે ડોઝ વચ્ચેના સમયગાળાને ધ્યાનમાં રાખવામાં આવે તો વેક્સીનેશન ઝડપથી શરૂ થઈ જવું જોઈએ, એમ ચેપી રોગોના નિષ્ણાંત ડો. આઈઝેક બોગોચે

રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. માત્ર ૧૩ ટકા જ જરૂરિયાત બીજા ડોઝની જોવા મળી હતી. જે ખરેખર એ વયજૂથ માટે ૫૦૦ ટકા વધશે. હવે પછીના છ અઠવાડિયા બાદ જ્યારે શાળાઓ ફરીથી શરૂ થશે ત્યારે ઓન્ટેરિયોમાં આ વયજૂથના ૪૨ ટકા લોકો પૂર્ણતયા વેક્સીનેટેડ છે. જ્યારે ૬૫ ટકાએ પહેલો ડોઝ લીધો છે. રાષ્ટ્રીય સ્તરે મળતા આંકડાઓ મુજબ ૧૭મી જુલાઈ સુધીમાં આ વયજૂથના ૭૦ ટકા

સમગ્ર કેનેડામાં વેક્સીનની કોઈ અછત નહીં હોવાનો નિષ્ણાંત તબીબોનો દાવો

બાળકોને ડોઝ અપાઈ ગયો છે. જેમાં ૪૩ ટકાને પહેલો ડોઝ અને ૨૬ ટકાને બંને ડોઝ અપાઈ ગયા છે. ડો. બોગોચે કહે છે કે, બાળકોને વેક્સીનનો વિષય નાજુક છે. એટલે બાળકો કે વાલીઓ પર દબાણ લાવી ન શકાય. એ લોકો સમજી જશે એવી આશા છે. કેમ કે, લાંબાગાળે તો વેક્સીન લેવાનો ફાયદો એમને જ થવાનો છે.

પીયરસન એરપોર્ટ પર વેક્સિનેશન સ્ટેટસ મુજબ ફ્લાઈટસને અલગ રાખવા પ્રથા

કસ્ટમસની પ્રક્રિયા પહેલા પ્રવાસીઓના વેક્સિનેશન સ્ટેટસની ચકાસણી કરાશે

ટોરોન્ટો

ટોરોન્ટોના પીયરસન એરપોર્ટ ઉપર આવનારા વિદેશી પ્રવાસીઓને વેક્સિનેશન સ્ટેટસ મુજબ અલગ તારવવામાં આવી રહ્યા છે. કસ્ટમસની પ્રક્રિયા પહેલા તેમના વેક્સિનેશન સ્ટેટસની ચકાસણી કરવામાં આવશે, એમ એરપોર્ટ સત્તાવાળાઓએ શનિવારે સ્પષ્ટ કર્યું હતું.

ટોરોન્ટોના પીયરસન એરપોર્ટના વરિષ્ઠ કમ્યુનિકેશન સલાહકાર બેવર્લી મેકડોનાલ્ડે મીડિયા સમક્ષ શનિવારે જણાવ્યું હતું કે, કેનેડામાં આવી રહેલા અમેરીકન કે અન્ય વિદેશી પ્રવાસીઓને વેક્સિનેશનના આધારે જુદા પાડવા માટે અલગ લાઈનમાં ઉભા રહીને કસ્ટમ્સ કાઉન્ટર સુધી જવું પડશે. આ નિર્ણય



બોર્ડર કલીયરન્સ માટે લેવાયો હોવાનું પણ એરપોર્ટ તરફથી જણાવવામાં આવ્યું હતું. કેમ કે, વેક્સીન લેનારા અને નહીં લેનારાઓ માટેના ધારાધોરણો અલગ છે. હાલમાં સંપૂર્ણ રીતે કેનેડાના વેક્સીનેટેડ પ્રવાસીઓને કવોરન્ટાઈનથી મુક્ત મળી શકે છે અને ટેસ્ટિંગમાં પણ રાહત મળી શકે છે. નવમી ઓગસ્ટ પછી અમેરીકાથી આવનારા વેક્સીનેટેડ પ્રવાસીઓને પણ એવી રાહત મળી શકશે. મેકડોનાલ્ડે એમ પણ કહ્યું હતું કે, અમે જાણીએ

છીએ કે, મહામારી પહેલાના અને અત્યારના આગમનના અનુભવમાં મોટો તફાવત છે. પીયરસન એરપોર્ટ કેનેડાનું પહેલું એરપોર્ટ છે જ્યાં આ રણનીતિનો અમલ થઈ રહ્યો છે. વાનકુંવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ આ રીતે અલગ આગમનની વ્યવસ્થા શરૂ કરાઈ છે અને પ્રવાસીઓનું ધ્યાન ખેંચાય એ રીતે સાઈનબોર્ડ રાખ્યા છે. તાજેતરમાં જ ઓન્ટેરિયોના પ્રિમીયર ડગ ફોર્ડે વેક્સીન પાસપોર્ટના વિચારને માંડી વાળ્યો હતો. કેમ કે ધાર્યા મુજબનું વેક્સીનેશન થયું નથી. તેમણે વેક્સીન પાસપોર્ટના પ્રસ્તાવને નકારી કાઢતા કહ્યું હતું કે, અમે સમાજમાં આ રીતે ભાગલા પાડી શકતા નથી. જો કે, વેક્સીન સર્ટિફિકેશનની યોજના આગળ વધી રહી છે.

કેનેડા કામચલાઉ વિદેશી કામદારોના નિયમોમાં ફેરફાર કરશે

ઓન્ટેરિયો

કેનેડાની સરકાર કામચલાઉ વિદેશી કામદારો માટેના નિયમોમાં મોટા ફેરફારો લાવી શકે છે. આ વાતના સંકેતો કેનેડા ગેઝેટમાં પ્રકાશિત એક લેખમાંથી મળે છે. કેનેડામાં આવનારા કામચલાઉવિદેશી કામદારો બે રીતે આવે છે. પહેલા જે ટેમ્પરરી ફોરીન વર્કર પ્રોગ્રામ (ટીએફડબલ્યુપી) અંતર્ગત આવે છે. જેમાં એવી કંપનીઓ જે કેનેડામાં એવા વિદેશી કામદારોને લાવવા માંગે છે જે કામ કોઈ કેનેડીયન નાગરિક કે રેસીડન્ટસ કરવા નથી માંગતા. બીજો માર્ગ ઈન્ટરનેશનલ મોબિલીટી પ્રોગ્રામ કે આઈએમપી હેઠળ આવે છે. જેમાં વિદેશીઓને કેનેડામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

આ બંનેમાં મોટો તફાવત એ છે કે પહેલા વિભાગમાં એલએમઆઈએ લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટની જરૂર પડે છે. જ્યારે બીજા વિભાગમાં એની જરૂર પડતી નથી. જેનાથી બંધર પડે છે કે, નોકરી દાતાએ કેનેડીયન ઉમેદવારો શોધી જોયા પણ એ નહીં મળતા વિદેશી કામદારોને રાખવા પડશે. જો કે, નોકરી ઈચ્છુકો બીજી વાત કરે છે. એમના જણાવ્યા મુજબ પહેલા વિભાગમાં તેમને પોતાના અધિકારો વિશે પુરતી જાણકારી નથી.

કામદારો અને નોકરી દાતાઓ માટે મહત્વના મુદ્દાઓ

- » નોકરીદાતાઓ અગાઉ ટીએફડબલ્યુઓની ભરતી માટેના નિયમોનું પાલન કરવાનું ટાળતા હોવાનું માનવામાં આવે છે. આવા નોકરીદાતા પોતાની માલિકીની અન્ય કંપનીઓ દ્વારા નોકરીએ રાખે છે.
- » ટીએફડબલ્યુઓ તેમના અધિકારો અથવા નિયમના અર્થઘટનથી અજાણ છે., ટીએફડબલ્યુઓ માટેની હેલ્થ કેર સુવિધાઓનો લાભ પણ તેઓ લઈ શકતા નથી., કેટલાક નોકરીદાતાઓ ટીએફડબલ્યુઓ પાસેથી ગેરકાયદે ભરતી ફી લે છે.
- » ટીએફડબલ્યુને હંમેશા એવો ભય રહે છે કે જો તેઓ કામની સ્થિતિ વિશે ફરિયાદ કરશે તો નોકરીદાતા બદલો લેશે, નવા દેશમાં વિદેશી કામદાર તરીકે પોતાને બીજાઓથી નબળા માને છે.
- » આ બધા કારણોને ધ્યાનમાં રાખીને કેનેડાએ વિદેશી કામચલાઉ કામદારોના હિતમાં કાનૂની સુધારાઓ કરવાનું નક્કી કર્યું છે. બધા નોકરીદાતાઓએ ટીએફડબલ્યુને આપવાપાત્ર લાભોનો દસ્તાવેજો કાર્યસ્થળે જાહેરમાં રાખવાની પણ તાકિદ કરી છે.
- » બધા નોકરીદાતાઓએ કામદાર અને સરકાર માટે રોજગારનો કચાર આપવાનો રહેશે. જે દસ્તાવેજ એ વાતનું સમર્થન કરશે કે, લેખિત કચાર મુજબ કામના સ્થળની સુવિધાઓ અને યોગ્ય વેતન આપવામાં આવે છે.
- » એ વાતની સ્પષ્ટતા કરવી કે નોકરીદાતા કોઈ કાર્યસ્થળનો દુરુપયોગ નથી કરતા, બદલાની કાર્યવાહી પણ દુરુપયોગ ગણાશે. એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કેનેડા (ઈએસડીસી)ને જો એવું લાગે કે નોકરીદાતા નિયમોનું પાલન નથી કરતા તો એલએમઆઈએની પ્રક્રિયા થોભાવી શકશે.
- » નવા નિયમો મુજબ એલએમએલ એની મંજૂરી સાથે ભરતી કરવી પડશે. જેમાં કાર્યસ્થળ સલામત અને શોષણમુક્ત હોય, કામદારોનું સન્માન જળવાય અને સરકારના નિયમોનું પાલન થાય એ જોવાની જવાબદારી નોકરીદાતાની રહેશે.

કેનેડીયન યુ ટ્યુબર્સે વિશ્વની સૌથી વધુ તેજસ્વી ફ્લેશલાઈટ બનાવી

ઓન્ટેરિયો : વિશ્વની સૌથી વધુ તેજસ્વી ફ્લેશલાઈટ કઈ હશે ? ફ્લેશલાઈટ જેણે એ બનાવી છે એ કહે છે, ખરેખર આ ફ્લેશલાઈટ વિક્રમસર્જક રીતે જાણકાર છે. એની તીવ્રતા એટલી છે કે, માત્ર એક જ ફ્લેશલાઈટથી આંખું ફૂટબોલનું મેદાન જળહળી ઉઠે. એનું નામ ધ નાઈટબ્રાઈટ ૩૦૦ રાખ્યું છે. એની મૂળ કલ્પના ઈલેક્ટ્રોનિક ડિઝાઈનર કિસ થિયેલેની છે, જે પાવરહાઉસ

કરીને એલઈડી વિશેની જાણકારી હોવાથી મારા માટે વિશાળ ફ્લેશલાઈટ બનાવવાનો પ્રોજેક્ટ યોગ્ય હતો. નાઈટબ્રાઈટ ૩૦૦ની ઝળકવાની તીવ્રતા ૫૦૧૦૩૧ લ્યુમેન્સ જેટલી છે. જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂકી છે. એ ઉર્જાના સ્ત્રોત કરતા બમણી ઝળકી શકે છે. જો સરખામણી કરીએ તો ૧૦૦ વોટનો ગોળો ૧૬૦૦ લ્યુમેન્સ જેટલો પ્રકાશ આપે છે. થિયેલે એ પોતાના



પ્રોજેક્ટની શરૂઆત અલગ રીતે કરી, તેણે વિશ્વની સૌથી વધુ ઝળકળતી ફ્લેશલાઈટ જે બજારમાં ઉપલબ્ધ હોય એના લ્યુમેન્સ જોયા.

એ ઈમાલેન્ટ એમએસ ૧૮ હતી. જે ૧૦૦૦૦૦ લ્યુમેન્સ જેટલો પ્રકાશ આપતી

કેનેડીયન યુટ્યુબ ચેનલ હેકસિમથ ઈન્ડસ્ટ્રીઝ ક્રિએટિવ ઓન્ટેરિયોમાં કામ કરે છે.

થિયેલે એ 'એઝ ઈટ હેપ્પન્સ' કાર્યક્રમની અતિથિ હોસ્ટ ગિનેલા માસાને કહ્યું હતું કે, 'ઘણા એવા યુટ્યુબ વીડીયો છે, જેમાં મોટી વોટર ગન હોય કે વિશાળ લેસર અને એવી જ અન્ય સામગ્રી હોય. એ જોયા બાદ અમને વિચાર આવ્યો કે, અમે આનાથી વધુ અઘરું અને ટેકનીકલી પડકારજનક બનાવીશું. તેણે વધુમાં કહ્યું કે, 'મારી પાસે ઈલેક્ટ્રોનિક ડિઝાઈનનું જ્ઞાન હતું અને ખાસ

હતી અને એની કિંમત લગભગ ૮૬૦ યુએસ ડોલર જેટલી હતી. એણે પોતાના નમુનામાં એવી ૩૦૦ એલઈડી રાખી.

હેકસિમથના વીડીયો માટે પહેલીવાર એનો ઉપયોગ કરી જોયો ત્યાં સુધી તેણે કિરણોને કેન્દ્રીત કરવાની યોજના બનાવી નહોતી. એટલે એનું ધારેલું પરિણામ મળ્યું નહોતું. ત્યારબાદ તેણે નાઈટબ્રાઈટ માટે સનગ્લાસનો ઉપયોગ કર્યો હતો જે ઘણો મુશ્કેલ હતો. છતાં તેણે હિંમત ધાર્યા વિના કામ ચાલું રાખ્યું અને આખરે સફળતા મેળવી.

વિમેન્સ બીચ વોલિબોલમાં કેનેડાની પાવન-પેરેડેઝનો સતત ત્રીજો વિજય



ટોક્યો: કેનેડાની સારાહ પાવન અને મેલિસ્સા હુમાના પેરેડેઝની જોડીએ ટોક્યો ઓલિમ્પિક્સની વિમેન્સ બીચ વોલિબોલ ઈવેન્ટમાં સતત ત્રીજો વિજય હાંસલ કર્યો હતો. સારાહ અને મેલિસ્સાની જોડીએ સ્વિટ્ઝર્લેન્ડની જોઆના હેટ્ટિચ અને એનોક વર્ગેની જોડીને સીધા સેટમાં 21-13, 24-22ના સ્કોરથી હરાવીને ગ્રૂપ-એમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. કેનેડીયન જોડીએ ત્રણ મેચમાં એક પણ સેટ ગુમાવ્યો નથી. સ્વિસ ટીમે બીજા સેટમાં ચાર મેચ પોઈન્ટ બચાવીને કેનેડાની જોડીને વળતી લડત આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

THINKING OF INVESTING?

INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

INVEST WITH **Metrobuild Capital** Sharia'h Compliant

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects **plus** your investment is secured against the assets.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

CALL 416 893 4585 TODAY!!!

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- Residential
- New Construction
- Investment
- Commercial

MOHAMMAD ABOWATH SALES REPRESENTATIVE | MAAZ ABOWATH BROKER | IBRAHIM ABOWATH SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX #1 with your Local REALTOR

*Not intended to Solicit client under contract.

LIFE INSURANCE

MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85) (Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE) CANCER OR INSURANCE declined by other companies
- CORPORATION OWNED LIF / CRITICAL ILLNESS INSURANCE (Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits

416.320.4614 Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

SUPER VISA INSURANCE
HARD TO BEAT OUR PREMIUMS

Davinder Singh Chawla



તંત્રી સ્થાનેથી

આસામ-મિઝોરમ સરહદે હત્યાકાંડ વફરેલા પ્રાદેશિકવાદનો વરવો નમૂનો

ભારતના પૂર્વોત્તરના મિઝોરમ, મેઘાલય અને આસામ વચ્ચે વર્ષોથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે ત્રણેય પ્રદેશો વચ્ચે નાના મોટા છમકલા થતાં રહ્યા છે. પરંતુ આસામ અને મિઝોરમ વચ્ચેનો આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પાંચ દિવસ પહેલાં જ બંને પ્રદેશોની પોલીસ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં આસામ પોલીસના પાંચ જવાનના મોત નિપજ્યા હતા. ભારતમાં બે રાજ્યો વચ્ચેનો વિવાદ ઉગ્ર અને હિંસક બને એ નવી વાત નથી. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં નદીઓના પાણી કે ભાષાને મુદ્દે ચાલતા વિખવાદ વર્ષો પછી પણ યથાવત છે. પણ સરહદી ઝગડામાં બે રાજ્યોની પોલીસ સામસામે આવી જાય અને બંને વચ્ચે ગોળીબાર થાય, તેમાં એક રાજ્યના પોલીસો મરી જાય એવું સોમવાર પહેલાં બન્યું ન હતું. સોમવારે આસામ અને મિઝોરમના સરહદના ઝગડામાં પાંચ જવાનોના મોતની ઘટના સમગ્ર દેશ માટે કાળી ટીલી સમાન છે.


 તંત્રી - પ્રકાશક
 સ્વદેશ

આ દિવસે બે દેશના સૈનિકો સામસામે આવીને લડે એ રીતે બંને રાજ્યોની પોલીસના જવાનો વચ્ચે જંગ છેડાયો અને તેમાં વાત ગોળીબારી સુધી પહોંચી હતી. તેમાં આસામના પાંચ પોલીસ જવાનનાં મોત થયાં. બંને રાજ્યોનાં સરહદી ગામોનાં લોકો વચ્ચે તો બંને રાજ્યોનાં સરહદી ગામોનાં લોકો વચ્ચે તો લાંબા સમયથી હિંસા થતી હતી. તેથી એ લોકો પણ તક મળતા હાથ સાફ કરવા આવી ગયા. બંને વચ્ચે જોરદાર પથ્થરમારો થયો અને તેમાં કેટલાયનાં માથાં ફૂટ્યાં. આ ઘટના પછી આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમાને મિઝોરમના મુખ્યમંત્રી જોરામથંગા વચ્ચે દિવર પર જંગ છેડાઈ. આ ઘટના શરમજનક હતી, પણ તેના કારણે લાજવાને બદલે બંનેએ બેશરમીથી આ ઘટનાનો રાજકીય લાભ લેવા માટે બકવાસ કર્યો. જે બાદ તેઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આ મામલે દરમિયાનગીરી કરવાનું કહીને ઘરભેગા થઈ ગયા.

આસામ-મિઝોરમ સરહદે બનેલી ઘટના અત્યંત આઘાતજનક છે. આ વિવાદના મૂળમાં આપણા રાજકારણીઓ છે અને તેમણે હલકટાઈ બતાવીને આ વિવાદ ઊભો કર્યો છે. આઝાદી વખતે ઉત્તર-પૂર્વમાં આસામ મોટું રાજ્ય હતું. જ્યારે મણિપુર અને ત્રિપુરા રજવાડાં હતાં. નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ ૧૯૬૩થી ૧૯૮૭ દરમિયાન આસામમાંથી અલગ થઈને નવાં રાજ્ય બન્યાં છે. એ રીતે ઉત્તર ભારતમાં સેવન સિસ્ટર્સ કહેવાતાં સાત રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. આ રાજ્યોમાં મિઝોરમ અને આસામની સરહદ અડકે છે. ૧૬૫ કિલોમીટર લાંબી આ સરહદ પર મિઝોરમના ઐઝવાલ, કોલાસિબ અને મામિત એ ત્રણ જિલ્લાનાં ગામ છે. જ્યારે આસામમાં કાયર, કરીમગંજ અને હેલાકાંડી એ ત્રણ જિલ્લાનાં ગામો છે. રસપ્રદ વાત એ છે કે, ૧૯૮૭માં હાલનું મિઝોરમ અસ્તિત્વમાં આવ્યું ત્યારે કોઈએ સરહદ મુદ્દે વાંધો નહોતો લીધો. પછીથી રાજકારણીઓએ આ મુદ્દાને ચગાવ્યો તેમાં મોટો વિવાદ થઈ ગયો. અંગ્રેજોના સમયમાં મિઝોરમ આસામનો ભાગ હતો. ત્યારે લુશાઈ પહાડી અને કાયર પહાડીને અલગ પાડીને અંગ્રેજોએ બે વિસ્તારને અલગ પાડ્યા હતા. ૧૯૭૩માં બેંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન નામે એ માટેનું નોટિફિકેશન બહાર પડાયેલું. આ જાહેરનામા હેઠળ અંદરના વિસ્તારોમાં ક્યો વિસ્તાર કોનો તે પણ નક્કી કરાયું હતું. અંગ્રેજોએ ૧૯૩૩માં બીજું જાહેરનામું બહાર પાડીને મણિપુર અને લુશાઈ પહાડી વચ્ચેની

સરહદ નક્કી કરી હતી.

ભારતને આઝાદી મળી તે પછી આસામમાંથી અલગ અલગ રાજ્યો બન્યાં. જે બાદ બેંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન નાબૂદ કરી દેવાયો હતો. પણ મણિપુર અને મિઝોરમમાં તેનો અમલ ચાલુ રહ્યો. આસામનો દાવો છે કે, આ રેગ્યુલેશન નાબૂદ થયો તેથી હવે લુશાઈની પહાડીનો જંગલનો વિસ્તાર આસામનો છે. જ્યારે મિઝોરમનો દાવો છે કે, મિઝોરમમાં તેનો અમલ ચાલુ છે તેથી અંદરના જંગલનો ૧૩૧૮ ચોરસ કિલોમીટરનો વિસ્તાર મિઝોરમનો છે. આ મુદ્દે સંઘર્ષ ચાલ્યા કરે છે અને વાટાઘાટો પણ થયા કરે છે પણ રાજકારણીઓના અક્કડ અને સ્વાર્થી વલણના કારણે ઉકેલ આવતો નથી. આસામનો દાવો છે કે, મિઝોરમનાં લોકો અમારી સરહદમાં ઘૂસી આવ્યા છે અને ત્યાં મકાનો બનાવીને જામી પડ્યાં છે. સામે મિઝોરમનું કહેવું છે કે, આ વિસ્તાર અમારો જ છે તથી અમને કોઈની મંજૂરીની જરૂર નથી. આસામના સરહદી જિલ્લા અને મિઝોરમના સરહદી જિલ્લાનાં ગામોમાં આ કારણે સતત લડાઈ થયા જ કરે છે. આસામ સરકાર આ વિસ્તારમાંથી મિઝો લોકોને ખદેડવા મથામણ કરતી રહે છે. પરંતુ તેમાં હજી સુધી ખાસ કોઈ ફરક પડ્યો નથી.

ભાજપ રાષ્ટ્રવાદની વાતો કરે છે અને લોકોને દેશપ્રેમના પાઠ ભણાવે છે. પણ ભાજપ શાસિત વિસ્તારોમાં જ આ પ્રકારનો હત્યાકાંડ થાય તો તેના દેશપ્રેમ સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. વળી અથડામણ પછી આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમાએ મંગળવારે સવારે જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને પછી હુંકાર કર્યો કે, આસામ પોતાની એક પણ ઈંચ જમીન કોઈને નહીં આપે. પહેલી વાત તો એ કે, આ જમીનનો મુદ્દો વિવાદમાં છે અને એ જમીન આસામની જ છે એ નક્કી નથી. મિઝોરમ આ જમીન પોતાની હોવાનો દાવો કરે છે. અંગ્રેજોના સમયમાં બે અલગ અલગ સીમા નક્કી થઈ તેનો આ ડબો છે અને આસામ જે સીમાને માન્ય રાખે છે તેને મિઝોરમ માન્ય રાખતું નથી. તેના કારણે બંને વચ્ચે વિવાદ છે. મિઝોરમ સાથેનો વિવાદ ઉકેલાય અને આ જમીન આસામની જ છે, એવું જાહેર થાય પછી સરમા ચોક્કસ તેના પર દાવો કરી શકે, એ પહેલાં નહીં. બીજી મહત્વની વાત એ છે કે આ ઝગડો બે દેશ વચ્ચેનો નથી કે સરમાએ આવા હુંકાર કરવા પડે. આ વિવાદ બે રાજ્યો વચ્ચેનો છે અને બંને રાજ્ય ભારતનાં જ છે. તમે રાષ્ટ્રવાદમાં માનતા હો તો એક રાજ્યની થોડીક જમીન બીજું રાજ્ય લઈ જાય તો એ કાંઈ મોટો વિવાદ કરવા જેવો મુદ્દો નથી. ભાજપે પોતાના મુખ્યમંત્રીના હુંકાર સામે વાંધો નથી લીધો તેનો અર્થ એ થાય કે, ભાજપ પણ સરમાની વાતને ટેકો આપે છે. બાકી તેમણે સરમાને વાર્યા હોત અને કહ્યું હોત કે, આ પ્રકારના લવારા કરવા નહીં. રાજકારણીઓ બીજાં રાજ્યોને બતાવી દેવાના અને પોતાના રાજ્યનો અધિકાર નહીં જવા દેવાના હુંકાર કરે છે પણ એ બધા પ્રાદેશિક પક્ષો છે. જો કે, ભાજપ તો રાષ્ટ્રીય સ્તરની પાર્ટી છે. દેશની એકતા અને અખંડિતતા મુદ્દે તે કોઈ સમાધાન કરે તે વાજબી નથી. આજે તે દેશમાં પણ સત્તામાં છે. સરમા અને આસામ ભાજપના નેતા પ્રાદેશિક સંકુચિતતાને પોષી રહ્યા છે તેની સામે લાલ આંખ કરવાની જરૂર છે. આ બંને રાજ્યોમાં ભાજપની સરકારો છે ત્યારે ભાજપે કેવા રાષ્ટ્રવાદનો પ્રસાર કરવો છે એ પણ વિચારવા જેવું છે. બંને રાજ્યના મુખ્યમંત્રીઓની ભાષા જોયા પછી તો કોઈમાં રાષ્ટ્રવાદનો છાંટો પણ હોય એવું લાગતું નથી. ગૃહમંત્રી અમિત શાહ હવે આ વિવાદનો કાયમી ધોરણે ઉકેલ લાવે તેવી આશા રખાઈ રહી છે.

manoj1968@yahoo.ca

INDEPENDENTLY OWNED AND OPERATED

JAY PATEL
BROKER

647.241.3818
jaypatel1323@gmail.com

"Let Me Make Your Dream Home Into A Reality"

Residential, Commercial & Investment in Real Estate

Off : 905.456.1000 | Fax : 905.456.1924
295 Queen Street East, Brampton, On., L6W 3R1

ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice
✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL

✓ Cockroach
✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI

✓ Animal Control
✓ Bird Control

✓ WASPS and
✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.
Written Guarantee And Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા ક્યોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$6.50 +Tax



CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise
Opportunity
in GTA

Call us for details

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine
Special
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



ચીખલી કસ્ટોડિયલ ડેથ કેસ: ચાર પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો

નવસારી

ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના બે શકમંદ આરોપીઓના થયેલા શંકાસ્પદ મોત મામલે અંતે પોલીસ દ્વારા બે પોલીસ અધિકારીઓ સહિત કુલ ચાર પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. બાઈક ચોરીના ગુનામાં શકમંદ આરોપી તરીકે લવાયેલા બે યુવાનોના પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાદ ભાજપ-કોંગ્રેસના આદિવાસી સમાજના નેતાઓએ ન્યાયિક તપાસની માગ કરી હતી. જે

બાદ પોલીસ દ્વારા ચાર પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાય છે.

વઘઈ તાલુકાના રહેવાસી રવિ જાદવ અને સુનિલ પવાર નામના યુવકોને બાઈક ચોરીના શંકાસ્પદ આરોપી તરીકે પોલીસ 19મી તારીખે ચીખલી પોલીસ સ્ટેશનમાં લાવી હતી. પોલીસે બંને શકમંદ આરોપીઓને પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં રાખ્યા હતા. 21મી તારીખે સવારના સમયે કોમ્પ્યુટર રૂમના પંખામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં બંને યુવકના મૃતદેહ મળી આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી

યુવાનોના શંકાસ્પદ મોત થતા પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાના વિરોધમાં સોમવારે ડાંગ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. આગેવાનોએ મૃતકના પરિવારજનોને સાથે રાખી પોલીસ સાથે બેઠક યોજી હતી. જેમાં પરિવાર દ્વારા તેઓ તરફથી આપવામાં આવેલી અરજીને જ ફરિયાદ ગણી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. પોલીસે પણ કાર્યવાહીની ખાતરી આપી હતી. બાદમાં હાલ પોલીસ ચાર પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં કુરિયરમાં બંદૂક મોકલી વેપારી પાસે કરોડની ખંડણી માંગી

સુરત

સુરતના સિટીલાઈટમાં રહેતાં લક્ષ્મણભાઈ જૈન વર્ષોથી રિંગરોડ નજીકના શિવશક્તિ માર્કેટમાં કાપડનો વ્યવાસ કરે છે. ગુરુવારે બપોરે તેઓ માર્કેટના ગેટ પાસે ઉભા હતા. ત્યારે એક સગીર છોકરો તેની પાસે આવ્યો હતો તેમને પાર્સલ આપ્યું હતું. આ સમયે તે છોકરાએ પોતે કુરિયરમાંથી આવું છું અને આ કુરિયર તમારું છે કહીને બોક્સ આપ્યું હતું. જે બાદ વેપારી પાર્સલ ખોલતા જ આવાક બની ગયો હતો. કારણ કે, પાર્સલમાં એક બંદૂક, ચાર જેટલી કાર્ટિલ મળી હતી. વેપારીએ પાર્સલમાં વધુ તપાસ કરી તો એક ચિટ્ટી

પણ મળી હતી. આ ચિટ્ટીમાં લખાયું હતું કે, 3 કરોડ દે દો, નહીં તો ખતમ કર દેંગે. પુલીસ કો બતાને કી કોશિશ મત કરના, વરના દેખ લેંગે." બાદમાં મોડી સાંજે વેપારીને એક ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો. જેમાં સામેથી બોલતા શખ્સે કહ્યું હતું કે, પહેલાં પાર્સલમાં બંદૂક અને ચિટ્ટી મોકલી છે. હવે તે તક પણ નહીં અપાશે. કરોડો રૂપિયાની ખંડણી મંગાતા વેપારીએ પોલીસનું શરણું લેવાનું નક્કી કર્યું હતું. ઘટના અંગે તેણે સલાબતપુરા પોલીસ સ્ટેશન પહોંચી જાણ કરતા પોલીસે ઘટનાને ગંભીરતાથી લેતા વેપારીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

તક્ષશિલા કાંડમાં ડોક્ટરની જુબાની લેવાઈ : 12 ઓગસ્ટે વધુ સુનાવણી

વિદ્યાર્થીઓનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે કેસની હકીકતને સમર્થન આપ્યું

સુરત

તક્ષશિલા હોનારત કાંડમાં સંડોવાયેલા 14 પૈકી 13 આરોપીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી કેસ કાર્યવાહી દરમિયાન સ્મીમેર હોસ્પિટલના વધુ એક ડોક્ટરની ઉલટ તપાસ પુરી થતાં એડીશનલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે આ કેસની વધુ સુનાવણી આગામી તા.12મી ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે. બે વર્ષ પહેલાં સરથાણા વિસ્તારમાં 22 માસુમ વિદ્યાર્થીઓનો ભોગ લેનાર તક્ષશિલા આગ કાંડની ગોઝારી ઘટનામાં સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસા બદલ કુલ 14 પૈકી સુરત મહાનગર પાલિકાના આરોપી અધિકારી

અતુલ ગોરસાવાલાને બાદ કરતાં અન્ય 13 આરોપીઓ વિરુદ્ધ કેસ કાર્યવાહીનો પ્રારંભ થવા પામ્યો છે. ફરિયાદપક્ષે ખાસ નિયુક્ત સરકારી વકીલ પી.એન.પરમારે સ્મીમેર હોસ્પિટલના વધુ એક તબીબી સાક્ષી ડૉ.વિજય કૌશિકની સરતપાસ લીધી હતી. આરોપીઓ તરફે કલ્પેશ દેસાઈ, રાજેશ ઠાકરીયા તથા મનિષ દેસાઈએ સાક્ષીની ઉલટ તપાસ લીધી હતી. જ્યારે બચાવપક્ષના વકીલ ઉપસ્થિત ન હોવાથી કોર્ટે તેમના ઉલટ તપાસનો હક બંધ કર્યો હતો. ડોક્ટર સાક્ષીની જુબાની પુરી થતાં કોર્ટે વધુ સુનાવણી તા.12મી ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.

લગ્નવિષયક

કેનેડા PR થયેલ લેઉઆ પાર્ટીદાર યુવક ઉંમર ૨૮ વર્ષ, ઉંચાઈ ૫'૧૦' વજન આશરે 80 Kg. અભ્યાસ BE (ETC) ભારતમાં તેમજ IT (Post Graduate Diploma) કેનેડામાં કરેલ હાલમાં Software Developerની જોબ કરતા કુંવારા નિર્વ્યસની હેન્ડસમ યુવક માટે CGA થયેલ તેમજ ઉચ્ચ અભ્યાસ જેવા કે એન્જિનીયરીંગ (IT)હોય, બેંકમાં જોબ કરતી હોય,ફાર્મસી ફીઝીયોથેરેપી જેવી ડિગ્રી ધરાવતી યુવતીઓના વાલીઓ તરફથી તેમજ જો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા, કે P.R. હોય તેવી યુવતીઓની પહેલી પસંદગી, બાયોડેટા ફક્ત ઈમેલ દ્વારા જ આવકાર્ય છે.

ઈમેલથી મોકલી આપવા માટે

Email : patelmarriage365@gmail.com

મુળ પાંડવનીયા (ઉમરેઠ) વાયા ડાકોર, તા. ઠાસરા, જી. ખેડા. ૩૮૮૨૨૫

Cell No. 416-587-4732

THANK YOU FRONTLINE WORKERS



MORTGAGE DILIGENT
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

5 Yrs Fixed @ 1.84%* High Ratio Only
5 Yrs Variable @ 1.15%* High Ratio Only
3 Yrs Variable @ 0.99%* (Special Promotion)



Rakesh Patel**
Vice President- Commercial.



Pranay Jani *



Nilesh Tailor *



Bala Shah*



Vijay Rana*



Rajesh Khurana, MBA
Principal Broker

Cell : 416-616-1300

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.* FSCO#10252,OAC,E&O.E * - Mortgage Agent, ** - Vice President


* Some conditions apply

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતાં જ ભુજનું ધોળાવીરા હવે દુનિયાના નકશામાં ચમકશે

આર્કિયોલોજી-ઈતિહાસ સાથે ઘરોબો ધરાવતા વર્ગને અભ્યાસ કરવાની તક મળશે

ભુજ

પ્રવાસનની ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહેલા કચ્છની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ હોય તેમ ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં કરવામાં આવતા ધોળાવીરા સાઈટ તેમજ ખીર વૈશ્વિક નકશા પર આવી જશે. અહિં હવે પ્રવાસનની નવી જ તકો ઉભી થશે. યુનેસ્કોની હેરિટેજ સમિતિની બેઠક મળી હતી જેમાં નવી નવી સાઈટોની સતવાર રીતે હેરિટેજ(ધરોહર) નો દરજ્જો આપવામાં આવ્યો છે જેમાં, ધોળાવીરાનો સમાવેશ થયો છે.



નવી દિશા સાંપડી પરિણામે દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છમાં આવતા થયા.

ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થતા ધરતીમાં ધરબાયેલા આ નગરની હવે વૈશ્વિક કક્ષાએ નવી જ ઓળખ ઉભી થશે. ઈતિહાસ અને આર્કિયોલોજીમાં રસ ધરાવતા લોકો આ સાઈટને જોવા અચુક દોડી આવશે. સફેદ રણની એક આગવી ઓળખ ઉભી થયા બાદ કચ્છને પ્રવાસન ક્ષેત્રે

કચ્છ ફરવા આવતા પ્રવાસીઓ ધોળાવીરા જોવા પણ અચુક પહોંચી જતા જો કે, અહિં પ્રાથમિક સુવિધાઓની ઉણપ હોવાની ફરિયાદ સમયાંતરે ઉઠતી પરંતુ હવે આ સાઈટનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ

થતા સ્થાનિકથી માંડીને રાજ્ય-કેન્દ્ર દ્વારા આ જગ્યાએ વિકસાવવાના પ્રયત્નોમાં જવાબદારો ગંભીર બનશે.

ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશથી પ્રવાસીઓ વધુ આકર્ષાશે તેમજ ધોળાવીરા-ખીર ઉપરાંત આસપાસની જગ્યાનો વિકાસ થશે. દેશ વિદેશના પ્રવાસીઓ આવવાથી સ્થાનિકોને રોજગારી મળી રહેશે.

રાજકોટમાં સગર્ભા પરિણીતાની પૂર્વ પતિ દ્વારા ગોળી ધરબી હત્યા મૃતક સરીતાના પેટમાં સાત માસનો ગર્ભ પણ હતો

રાજકોટ

શહેરના કાલાવડ રોડ પરનાં રવી પાર્કમાં બ્લોક નંબર ૧૧૯/૨માં રહેતી સરીતા પંકજ ચાવડા નામની ૨૭ વર્ષની સગર્ભા પરિણીતાની ઘરમાં ઘુસી યુપી રહેતા તેનાં પૂર્વ પતિ આકાશ રામાનુજ મોર્યાએ પોઈન્ટ બ્લેન્ક રેંજથી ફાયરિંગ કરી છાતીમાં ગોળી ધરબી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તે રીક્ષામાં ભાગ્યો હતો. પરંતુ જાગૃત નાગરિકોને કારણે ગણત્રીની મીનીટોમાં જ માધાપર ચોકડી પાસેથી ઝડપાઈ ગયો હતો. તેણે પત્નીએ બીજા લગ્ન કરી લેતાં અને તેનાં બાકી નીકળતા ૩.૫૦ લાખ નહીં આપતા આવેશમાં આવી આ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે.

હત્યાનો ભોગ બનનાર સરીતાનાં પિતા દિલીપ કહાર પશ્ચિમ બંગાળનાં રાણીગંજ જિલ્લામાં રહે છે. થોડા વર્ષો પહેલા સરીતા એકલી કામની તલાશમાં યુપીનાં ગોરખપુર આવી ગઈ હતી. જ્યાં તે આરોપી આકાશના પિતા કે જે રેડીમેઈડ કાપડની દુકાન

ધરાવતા હતાં ત્યાં નોકરીએ લાગી ગઈ હતી. જેને કારણે તે આકાશ સાથે પરીચયમાં આવતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગરતા ૯ મે ૨૦૧૯નાં રોજ બન્નેએ લગ્ન કરી લીધા હતાં. જો કે થોડા સમય સુધી બધું બરાબર ચાલ્યા બાદ બન્ને વચ્ચે વાંધો પડતા અલગ થઈ ગયા હતાં. આકાશે બીજા લગ્ન કરી લીધા હતાં. જ્યારે સરીતાએ પણ રવીપાર્કમાં રહેતા અને ડ્રાઈવીંગ કરતા પંકજ સાથે ગોરખપુરમાં નવેમ્બર ૨૦૨૦માં બીજા લગ્ન કરી રાજકોટ આવી ગઈ હતી. તેણે જ્યારે આકાશ સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેણે તેને ગોરખપુરમાં બ્યુટીપાર્લર શરૂ કરવા માટે અને તેના પરિવારને મદદ કરવા કટકે કટકે રૂ. ૩.૫૦ લાખની મદદ કરી હતી. જે રકમ આપ્યા વગર જ સરીતા રાજકોટ આવી પતિ સાથે ઠરીઠામ થઈ ગઈ હતી. જો કે રકમ કરતા તેણે બીજા લગ્ન કરી લેતાં તેનો આકાશને રંજ હતો અને તે તેની ઉપર રોષે ભરાયો હતો.

રાજ્યમાં મેઘાની ધબડાટી : સૌરાષ્ટ્રના 12થી વધુ ડેમ છલકાઈ જવાને આરે

જુનાગઢ

અવિરત વરસાદના પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. જ્યારે 20 ડેમમાં પાણીની આવક બીજા દિવસે પણ ચાલુ રહેતા તે તમામ ભયજનક સપાટી પાસે પહોંચી ગયા છે. આ તમામ ડેમ ટુંક સમયમાં જ છલકાવવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના એક ડેમનાથી વધુ ડેમમાં 70 થી 100 ટકા પાણીનો ભરાવો થઈ ગયો છે. તેથી તેને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ભારે



વરસાદથી હાઈએલર્ટ જાહેર કરાયેલા ડેમમાં કાબરકા, વર્તુ-1, વેણુ-2, આજી-2, વેરી, છાપરવાડી-1, ઘોડાખોઈ, મચ્છુ-3, કુલઝર-1, વાડીસંગ, કુલઝર ડેમનો સમાવેશ થાય છે.

જ્યારે મોજમાં 0.69, આજી-3માં 0.75, ડોંડીમાં 1.31, છાપરવાડી-2માં 1.31, મચ્છુ-1માં 0.10, મચ્છુ-2માં 1.31, ડેમી-2માં 0.16, બંગાવડીમાં 0.66, બ્રાહ્મણીમાં 0.39 અને વાંસલ ડેમમાં પાણીની સપાટી 0.૧૬ ફૂટ ઉંચે ગઈ છે.

સક્કરબાગ ઝૂના 71 સિંહોમાંથી 40 સાવજોને અન્ય ઝૂમાં મોકલાશે

જુનાગઢ

સમગ્ર દેશમાં એશિયાટિક સાવજોનું એકમાત્ર બ્રિડિંગ સેન્ટર જુનાગઢના સક્કરબાગ ઝૂમાં હાલ ૭૧ જેટલા સિંહો છે, જેમાંથી ૪૦ જેટલા સિંહોને દેશના જુદા જુદા પ્રાણી સંગ્રહાલયોમાં મોકલવા સરકારે મંજૂરી આપી દીધી છે, જે સિંહોના બદલામાં આવેલા પ્રાણીઓને કેવડીયાની શોભા વધારવા લઈ જવાશે તેવી કવાયત શરૂ કરવામાં આવી છે. જુનાગઢ સક્કરબાગ ઝૂમાં હાલ ૭૧ જેટલા સિંહો છે, જેમાં ૨૪ નર, ૩૫ માંદા, અને ૧૨ બચ્ચા છે, આ ૭૧ સિંહો પૈકી ૪૦ જેટલા સિંહોને દેશના અન્ય ઝૂ અને સંગ્રહાલયોમાં મોકલવા માટે છેલ્લા કેટલાક સમયથી કવાયત ચાલી રહી હતી.

જેતપુરમાં રેલવે ટ્રેક પર રમતા બે માસૂમ ભૂલકાં ટ્રેન હેઠળ કચડાયા

જુનાગઢ

જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન ઉપર બપોરે ૧.૪૦ વાગ્યે ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રેલવે ટ્રેક ઉપર ધસમસતી આવી રહી હતી. ત્યાં નજીક જ બે પરપ્રાંતીય બાળકો રમત ગમતમાં મશગુલ હોય ટ્રેન આવતી જતા બાળકોને કઈ તરફ જવું તે કાંઈ સમજ પડે તે પહેલા જ એક બાળકનું ટ્રેન નીચે જ મૃત્યું થયું હતું. જ્યારે બીજા બાળકને ટ્રેનની હડકંટે લેતા તે પુલ નીચે પડી જતાં તેનું મૃત્યું થયું હતું. આ બંને પરપ્રાંતીય મજૂરોના બિહાર રાજ્યના બાળકો આર્યન શંભુ પ્રસાદ(ઉ.૧૧) તથા દિપુ મંડલ(ઉ.૭) હાલ રામૈયા વિસ્તારમાં રહેતા હોવાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Imperial

PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services

2 Fogging Services

3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.
Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets

10% Off

on your first home service

*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

સ્વદેશ

CANADA

Registration # 869127209
Publication Mail Agreement /
Email : info@swadesh.news

WWW.SWADESH.NEWS

Return Undeliverable Canadian Address To :

Shree Balaji Inc.

MAILING ADDRESS

23 Lyric Road,
Brampton ON L6S 0B4.
416-996-7755

Registered Address

713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi	<p style="font-size: small;">Designed By</p> <p>Sabir Daroga</p> <hr/> <p>Mevada Piyush</p> <hr/> <p>Firoz Shaikh</p>
Director : Nilesh Tailor	
Sub Editor : Chhaya Gandhi	
Montreal Bureau : Vijay Patel (514-826-7442)	
<p>GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)</p>	



ત્વચાની સુંદરતા વધારવા ટ્રાય કરો વિવિધ ફેસ પેક

ચહેરા પર મલાઈનો ઉપયોગ

ઘર બહાર વધુ પડતુ નીકળવું પડતું હોય તો ચહેરા પર ધૂળ માટી જામી જતી હોય છે. જેથી ટેનિંગ થઈ જાય છે. પરિણામે ચહેરાની ચમક ઓછી થઈ જાય છે આ સમસ્યાને શરૂઆતથી જ દૂર કરવી જરૂરી છે, નહીં તો પછીથી દૂર કરવામાં તકલીફ થાય છે. આવામાં જોકે મલાઈ ઉત્તમ ઉપાય સાબિત થાય છે.

રક્ત ત્વચાને મુલાયમ કરે છે

એક ચમચો ફુલ કીમ દૂધની મલાઈ લઈ તેમાં એક ચમચો મધ ભેળવી લેવું. આ પેકને ચહેરા પર લગાડી સુકાઈ જાય પછી ચહેરા ધોઈ નાખવો.

ત્વચાને ચળકતી કરે છે

નિસ્તેજ થઈ ગયેલી ત્વચામાં ગ્લો લાવવા માટે મલાઈનો ફેસ પેક રામબાણ ઈલાજ છે. તેમાં એક ચમચો ચણાનો લોટ ભેળવી ઘટ્ટ પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ચહેરા પર લગાડી સુકાઈ જાય પછી ચહેરા ધોઈ નાખવો. ચણાના લોટના સ્થાને હળદરનો ઉપયોગ પણ કરી શકાય. મલાઈ હોય તેના પા ભાગ જેટલી હળદર ભેળવી.



સનબર્ન અને ટેનિંગ દૂર કરવા

દૂધની મલાઈ સનબર્ન અને ટેનિંગ દૂર કરવાનો સુંદર નુસખો છે. એક મોટો ચમચો મલાઈ, અડધો ચમચો મધ અને અડધો ચમચો લીંબુનો રસ લેવો. આ સામગ્રીઓને બરાબર ભેળવી ઘટ્ટ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવું. આ પેકને ગરદન, હાથ અને પગ પરની ટેનિંગ દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

મૂત ત્વચાને દૂર કરવા

ઓટમીલને મલાઈ સાથે મિક્સ કરીને ત્વચા પર લગાડવાથી મૂત ત્વચા દૂર થાય છે. એક મોટો ચમચો મલાઈ લઈ તેમાં એક ચમચો ઓટમીલ ભેળવ ચહેરા પર લગાડવું. સુકાઈ જાય એટલે ગોળાકારમાં ધીરે ધીરે હળવા હાથે રગડીને સ્ક્રબ કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે.

ત્વચાને યુવાન રાખવા

ત્વચાને યુવાન રાખવા માટે એક ચમચો મિલ્ક



પાણીથી ધોઈ નાખવા.

નખને પોષણ આપવા માટે

નખના પોષણ માટે એક મોટો ચમચો બદામ અને એરંડિયાનું તેલ લઈ તેમાં થોડું કીમ ભેળવી હાથ અને નખ પર લગાડી ૧૫-૨૦ મિનીટ મસાજ કરવાથી નખને પોષણ મળે છે.

વાળની ચમક માટે


વાળને ચમકીલા કરવા માટે એક કેળું, એક ચમચો મલાઈ પા ભાગ એરંડિયાનું તેલ લઈને હેર માર્ક બનાવવો. અડધો કલાક વાળમાં લગાડી શેમ્પુથી વાળ ધોઈ નાખવો.

ડાઘ ધાબા દૂર કરવા

એક ચપટી હળદર એક મોટો ચમચો મિલ્ક પાવડર અને બે મોટા ચમચો મધ તેમજ અડધો લીંબુનો રસ ભેળવી ત્વચા પર લગાડવું. સુકાઈ જાય પછી ધોઈ નાખવું.

ત્વચા પર ટેનિંગ દૂર કરવા

ત્વચા પરથી ટેનિંગ દૂર કરવા ટમાટાની પ્યુરી બનાવી ગરદન, હાથ-પગ પર લગાડી ધોઈ નાખવું.



OTP શેર કર્યા વિના 75,000 ઉપડી ગયા



મુંબઈમાં પવાઈ પોલીસે એક નવા પ્રકારનો સાયબર કાર્ડમ નોંધ્યો. જેમાં પીડિત દ્વારા કોઈ ટ્રાન્ઝેશન કર્યું ન હતું અને કોઈ અન્ય વ્યક્તિ સાથે OTP શેર કર્યો ન હતો પરંતુ તેના એકાઉન્ટ માંથી રૂપિયા 75,000 જેટલા કપાઈ ગયા. જેમાં સાયબર સેલ ના નિષ્ણાંતો જણાવે છે કે આ એક નવી પદ્ધતિ છે જેમાં છેતરપિંડી કરનારાઓ પૈસા ચોરવા માટે મેસેજિંગ એપ્લિકેશનની સુવિધાઓનો દુરુપયોગ કરે છે.

પીડિત જણાવે છે કે, 27 જૂન ના રોજ ઓનલાઈન નાસ્તો ઓર્ડર કરવા માટે ગૂગલ પર સારી અને નામાંકિત રેસ્ટોરન્ટ વિષે સર્ચ કર્યું જેમાંથી તેને એક રેસ્ટોરન્ટ માંથી ઓર્ડર કરવાનું નક્કી કર્યું અને તેના કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કર્યો પરંતુ રેસ્ટોરન્ટ બીજી હોવાથી ત્યાંના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ નંબર પર ટૂંક સમયમાં કોલ-બેક કરશે. ત્યારબાદ ફરી કોલ આવ્યો અને પીડિતે તેના ઓર્ડરની વિગત આપી અને તેને પેમેન્ટ મોડ વિષે પૂછવામાં આવ્યું તો પીડિતે COD (Cash on Delivery) વિકલ્પ પસંદ કર્યો પરંતુ રેસ્ટોરન્ટના મેનેજરએ જણાવ્યું કે ગ્રાહકે ફરજિયાતપણે ઓનલાઈન પેમેન્ટ જ કરવું પડશે. ત્યારબાદ રેસ્ટોરન્ટ માંથી પીડિતના મોબાઈલ પર એક લીંક આવી. જેને

લીંક પર ક્લિક કરતા જ Spring SMS નામની એપ્લિકેશન પીડિતના મોબાઈલમાં ઈન્સ્ટોલ થઈ ગઈ અને આ એપ્લિકેશન ઓપન કર્યા વિના બેંક માંથી ટ્રાન્ઝેશન સકસેસ નો મેસેજ આવ્યો જેમાં પીડિતનું બીલ માત્ર 350 રૂપિયાનું હતું પરંતુ તેના એકાઉન્ટ માંથી 75,000 રૂપિયા કપાઈ ગયા હતા. જેની જાણ પીડિતએ તરત જ બેંક ના કસ્ટમર કેર ડીપાર્ટમેન્ટમાં કરી. તેઓએ સૂચવ્યું કે તમે તરત જ સમગ્ર ઘટનાની જાણ સાયબર સેલ માં કરો અને દિલાસો આપ્યો કે તેઓ જલ્દીથી જ એક્સન લેશે.

પીડિતે આ સમગ્ર ઘટનાની ફરિયાદ પવાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. પોલીસે આ ફરિયાદની જાણ રીતેશ ભાટિયાને કરી જે V4WEB સાયબર સિક્યુરીટીના સ્થાપક અને સાયબર કાર્ડમ ઈન્વેસ્ટિગેટર છે. તેઓ જણાવે છે કે આ એક નવા પ્રકારનો સાયબર કાર્ડમ છે અને પીડિત પાસેથી પૂરતી માહિતી મેળવીને તેઓ ઈન્વેસ્ટિગેશન કરશે અને પીડિતને પૂરતી મદદ કરશે. વધુમાં તેઓ જણાવે છે કે કોઈપણ અજાણી લીંક પર ક્લિક ન કરવું અને એપ્લિકેશન પણ ઈન્સ્ટોલ ન કરવી. આવું કરવાથી તમે પણ પોતાના રૂપિયા ગુમાવી શકો છો.

@beinghumanmj



First Flight
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6 11 LB \$55 વધુ દર LB ના \$6 23 KG \$185, વધુ દર KG ના \$10 30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>
---	--

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

<p>Brampton (West) 519, Ray lawson boulevard, Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, Opposite Vegetables Market. Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p>Scarborough WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY CLOSED : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p>Mississauga 2960 Drew Road, Unit-158, Mississauga ON L4T 045 Great Punjab Plaza, Next to Malton Gurudwara. : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: MON-FRI : ----- 9.30 AM to 8.00 PM</p>
--	---	---

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com

**ઇન્ડિયન આઇડલ 12:
ફિનાલેમાં સામેલ નહીં
થાય નેહા કક્કડ?**



બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝની મોસ્ટ અમેઝિંગ અને પોપ્યુલર સિંગર નેહા કક્કડ છેલ્લાં કેટલાંય વર્ષોથી સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલને જજ કરી રહી છે. ઇન્ડિયન આઇડલ 12માં પણ નેહાએ જજની ખુરશી સંભાળી. પરંતુ શોની અધવચ્ચેથી તે ગાયબ થઈ ગઈ. નેહાની જગ્યાએ હવે શોમાં તેની બહેન સોનુ કક્કડ જજ બનીને કંટેસ્ટન્ટસનો જુસ્સો વધારી રહી છે. દીવીનો સૌથી મોટો સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ પોતાના ફિનાલેની તરફ આગળ વધી રહ્યો છે. ફિનાલેની ડેટ સામે આવ્યા બાદ ફેન્સ અંદાજો લગાવી રહ્યા હતા કે નેહા ફિનાલે એપિસોડમાં દેખાય શકે છે. જો કે હવે આ અંગે એક મોટી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર નેહા કક્કડ ઇન્ડિયન આઇડલ 12માં હવે દેખાશે નહીં અને ના તો ફિનાલે એપિસોડમાં સામેલ થશે. સૂત્રોએ કહ્યું કે નેહા છેલ્લાં કેટલીક સીઝનથી ઇન્ડિયન આઇડલ શોને જજ કરી રહી છે અને હવે તે બ્રેક લેવા માંગે છે.



મેટ્રોપોલિટન કોર્ટે રાજ કુંદ્રાના જામીન ફગાવ્યા

સેબીએ ત્રણ લાખનો દંડ ફટકાર્યો

પોર્ન ફિલ્મ કેસમાં મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા રાજ કુંદ્રાની જામીન અરજી ફગાવી દેવાઈ છે. બુધવારે થયેલી સુનાવણીમાં ઇન્વેસ્ટિગેટિંગ અધિકારીએ કોર્ટને જણાવ્યું કે, કુંદ્રાને જામીન આપવામાં આવશે તો આ કેસ સાથે સંકળાયેલા ઘણા પુરાવા સાથે છેડછાડ થવાની શક્યતાઓ રહેલી છે. તે ઉપરાંત આ કેસમાં આરોપીઓની પૂછપરછ બાકી છે અને તેમના સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવાના છે. કોર્ટે કુંદ્રા ઉપરાંત તેની કંપનીના આઈટી અધિકારી રેયાન થોર્પેના પણ જામીન ફગાવી દીધા. હવે કુંદ્રાની જામીન અરજીની બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બીજી તરફ સેબીએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા તથા તેમની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝ સામે ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોના ભંગ બદલ ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.



શિલ્પાની ફરીથી થઈ શકે છે પૂછપરછ

પોર્નગ્રાફી કેસે ચકચાર મચાવી હતી. બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની આ મામલામાં મુશ્કેલીઓ હજી પૂરી થઈ નથી. અભિનેત્રી હજી પણ મુંબઈ પોલીસની કાર્યમ ધ્યાનમાં રડાર પર છે અને તેની વધુ પૂછપરછ થઈ શકે છે. કાર્યમ ધ્યાનમાં કહેવું છે કે આ કેસમાં અભિનેત્રી શર્લિન ચોપરાને સાક્ષી બનાવવામાં આવી રહી છે. આ સાથે જ આરોપી અરવિંદ શ્રીવાસ્તવને પણ તપાસમાં સહયોગ આપવા જણાવ્યું છે.

પોર્ન ફિલ્મોની આવક ૧૫૦ કરોડ સુધી લઈ જવાનો પ્લાન હતો

મુંબઈ: પોર્ન ફિલ્મ કેસમાં કાર્યમ ધ્યાનમાં દ્વારા કુંદ્રાને કોર્ટમાં રજૂ કરવા દરમિયાન કેટલાક ડિજિટલ ડેટા પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ડેટા મુજબ રાજ કુંદ્રા પોતાની એપ અને પોર્ન ફિલ્મ કંપનીની ટેલેવિઝન 150 કરોડ સુધી લઈ જવા માંગે છે. તેના દ્વારા તેણે વર્ષે 30 કરોડના પ્રોફિટની પણ આશા રાખી હતી. રાજ કુંદ્રાએ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીના નાણાકીય વર્ષનો ટેલેવિઝન અને પ્રોફિટને પ્લાન તૈયાર કરી લીધો હતો. મહત્વની વાત એ છે કે, તેણે બોલિવૂડના નામની કંપની બનાવી હતી અને તેની એપ દ્વારા પોર્ન ફિલ્મોનો કારોબાર આગળ વધારવાનો પ્લાન બનાવ્યો હતો.

ગહના વશિષ્ઠે ખોલ્યા રાજ, OTT પ્લેટફોર્મ પર પધરાવાતુ ઇરોટિક કન્ટેન્ટ

પોર્નગ્રાફી કેસમાં રાજ કુંદ્રાને ઝડપી લીધા પછી એક પછી એક હકીકત સામે આવી રહી છે. આ કેસમાં ગહના વશિષ્ઠનું નામ સામે આવ્યું છે. તેઓ કહે છે કે કામત આવા વીડિયોની માંગણી કરતો હતો જે પોર્ન તો નહીં પણ ઇરોટિક હોય. ઉપરાંત તેમાં અશ્લીલ સામગ્રી પણ હતી. નિર્માતાઓ કલાકારને ફાઈનલ કરતા હતા. વીડિયો માટે લોકેશન નક્કી કરાતું અને ત્યારબાદ શૂટ કરવા જવાનું ક્યારે શરૂ કરશે. કામત કલાકાર સાથે અંગત રીતે વાત કરતો હતો. શૂટિંગ પહેલાં અને પછીકલાકાર બોલ્ડ ટ્રશ્યો કરવા તૈયાર છે તેની ખાતરી કરવામાં આવતી હતી. ગહનાએ વધુમાં કહ્યું કે, હોટશોટ માટેના શૂટનું બજેટ લગભગ ત્રણ લાખ રૂપિયા હતું. નિર્માતા 25થી 30 હજાર તેની પાસે રાખતો હતો. વધુમાં, કલાકારને ચુકવણી, સપોર્ટ સ્ટાફ, કપડાં અને સ્થાન. નિર્માતા આ શૂટને થોડા દિવસોમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો, કારણ કે શૂટના વધુ દિવસો થાય તો વધુ ખર્ચ થાય. ગહના વશિષ્ઠે થોડા સમય પહેલાં હોટશોટ માટે કન્ટેન્ટ બનાવ્યું હતું. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે કોઈ પણ સ્ત્રીને આ રીતે શૂટ કરવા ઉકસાવાતી નહોતી કલાકાર પોતાની મરજીથી અને રાજીબુશીથી કામ કરતો જેની તેને કિંમત મળતી હતી.



PayLessTravel
Fly Well ... Pay Less

વિમાની સેવાના બુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ

Call for all your Air Travel Services

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

Call us for the Lowest Fares Coming From India to Canada Also

Please Call 905-281-2627

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time

GUARANTEED ACCESS TO PRE-CONSTRUCTION CONDOS IN DOWNTOWN TORONTO & GTA

CALL ME NOW!

BUY • SELL • INVEST

Nadir Shah
100% Professional, 0% Attitude
Sales Representative

416.625.3580
nadir.shah@sympatico.ca

4030, Sheppard Ave. East, Toronto, ON M1S 1S6
T: 416.291.0929 (24/7) F: 416.291.0984

CENTURY 21
Regal Realty Inc. Brokerage
Member Broker

Not intended to solicit buyers or sellers already under a contract.



॥ સંસ્કૃતિ ॥

હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!
રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, સ્મતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્ટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



પોર્ન ફિલ્મ માટે વિદેશમાં એપ લોન્ચિંગની કંપની ખોલી કાયદાની છટકબારીનો ઉપયોગ

મોબાઈલ એપથી પોર્નોગ્રાફીનો ધીકતો ધંધો

મુંબઈ પોલીસે પોર્નોગ્રાફીનો ધંધો કરવા મુંબઈ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી કાર્યવાહીએ સમગ્ર ભારતમાં ચક્રવાર મચાવી છે. જો કે, મોબાઈલ એપ બનાવી પોર્નોગ્રાફીનો વેપાર કરવામાં હજી પણ અનેક લોકો સંકળાયેલા છે. અને તેમના સુધી પહોંચવામાં પોલીસને વર્ષો નીકળી જશે. શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા પહેલાં હોટશોટ નામની મોબાઈલએપ વડે પોર્નોગ્રાફીનો વેપાર કરતો હતો. તેને જ્યારે લાગ્યું કે સરકાર હોટશોટ નામની એપ પર પ્રતિબંધ મૂકશે, ત્યારે તેણે બોલિક્રેમ નામની એપ લોન્ચ કરી હતી. આજે હોટશોટને ગૂગલ પ્લે સ્ટોર પર પ્રતિબંધિત કરવામાં આવી છે, પણ ઉલ્લુ, ગુપચુપ, કૂકુ, ફિલ્મ મુવીસ વગેરે ૩૦ જેટલી એપ હજી ગૂગલ પર છે. આ એવી એપ્લિકેશન છે જેમાં રૂપિયા લઈને પોર્નોગ્રાફી પીરસવામાં આવે છે. બાલાજી ફિલ્મની અલ્ટ બાલાજી નામની એપ માત્ર ઈરોટિક ફિલ્મો બતાવવાનો દાવો કરે છે, પણ તેમાં ક્યારેક પોર્નોગ્રાફીની કક્ષાનાં દર્શ્યો બતાવાય છે. રાજ કુન્દ્રાની ધરપકડ પછી પણ આ ગંદા ધંધા પર કોઈ અંકુશ આવશે તેવી શક્યતા ઝાઝી છે.

હવે પોર્નોગ્રાફી એપના માધ્યમથી વેચીને કમાણી કરવાનો ધીકતો ધંધો ધમધમી રહ્યો છે. આ પોર્નોગ્રાફી મફતમાં મળતી નથી. રૂપિયા ખર્ચીને મોબાઈલ એપ ડાઉનલોડ કર્યા પછી પણ દરેક ફિલ્મ માટે અલગથી રૂપિયા ચૂકવવાના હોય છે. આ રીતે પોર્નોગ્રાફિક ફિલ્મ થકી કમાણી વધી ગઈ હોવાથી મુંબઈમાં પોર્નોગ્રાફીનો મોટો ઉદ્યોગ ઊભો થઈ ગયો છે. ભારતમાં કાયદા વડે પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ પોર્નોગ્રાફીનો વેપાર કરનારાઓ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતની યુવા પેઢી અને સ્કૂલમાં ભણતાં બાળકો સુદ્ધાં પોર્નોગ્રાફીના ગ્રાહકો થઈ ગયા છે.

હાલમાં કોરોનાને કારણે બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવતા થયા છે. જેને કારણે દરેક બાળક હવે સ્માર્ટ ફોનથી પરિચિત થઈ ગયો છે. માતા-પિતાની ગેરહાજરીમાં તે સ્માર્ટ ફોનનો કેવો ઉપયોગ કરે છે તેની પણ ચિંતા કરવી પડે તેમ છે. આજે ગૂગલ પ્લે સ્ટોરમાં એવી સંખ્યાબંધ એપ છે, જેમાં અશ્લીલ દર્શ્યોથી માંડીને પોર્ન ફિલ્મો જોઈ શકાય છે. શૃંગાર અને પોર્ન વચ્ચેની પાતળી ભેદ રેખા ક્યારે ઓળંગી જવામાં આવે છે, તેનો પણ ખ્યાલ રહેતો નથી. આ કારણે જ શિલ્પા શેટ્ટીએ પોતાના પતિનો બચાવ કરતાં કહ્યું હતું કે “રાજ કુન્દ્રા પોર્નોગ્રાફિક નહીં પણ શૃંગારિક ફિલ્મો બનાવે



છે.” મોબાઈલ પર પોર્નોગ્રાફીનો જે વેપાર ચાલે છે, તેના ગ્રાહકો મેટ્રો સિટીના નથી હોતા, પણ બીજા અને ત્રીજા દરજ્જાનાં શહેરોના હોય છે. કોવિડ-૧૯ને કારણે લોકોને મહિનાઓ સુધી ઘરમાં ગોંધાઈ રહેવાની ફરજ પાડવામાં આવી હતી. આ જ કારણોસર છેલ્લાં દોઢ વર્ષમાં પોર્ન ફિલ્મોના કારોબારમાં જંગી ઉછાળો આવ્યો છે. લોકડાઉન દરમિયાન મુંબઈમાં હિન્દી ફિલ્મોનું શૂટિંગ પણ બંધ હતું. તેને કારણે નાનાં શહેરમાંથી મુંબઈ આવીને ભાડાંના ફ્લેટમાં રહેતી અનેક નાની અભિનેત્રીઓને ગુજરાત ચલાવવામાં મોટી મુશ્કેલી ઉભી થઈ હતી. આવા કપરા સમયે રાજ કુન્દ્રા જેવા પોર્ન નિર્માતાઓએ આવી અભિનેત્રીઓની લાચારીનો ફાયદો ઉઠાવ્યો. રાજ કુન્દ્રા અનેક અભિનેત્રીઓની આર્થિક સ્થિતિથી વાકેફ હતા તેથી તેમણે આવી અભિનેત્રીઓને

પ્રાસંગિક
ધવલ શુક્લ

વિદેશની જેમ ભારતમાં પણ પોર્ન કલ્ચર વિકસવા માંડ્યું, રાજ કુન્દ્રાની ઘટના તેનો મજબૂત પુરાવો છે, ૨૦૨૪ સુધીમાં આ ખેલાડીએ અબજોના વેપારની યોજના ઘડી હતી

પોર્ન ફિલ્મોની ઓફર આપી. સામાન્ય રીતે પોર્ન ફિલ્મોમાં કામ કરવા માટે કોઈ દબાણ કરવામાં આવતું નથી. પોર્ન ફિલ્મોનું પ્રોડક્શન અચૂકપણે ભારતમાં થાય છે, પણ તેનાં વિતરણ માટે વિદેશી કંપનીની મદદ લેવામાં આવે છે. ભારતના કાયદા મુજબ જો કોઈ પોર્નોગ્રાફિક વેબસાઈટનું સર્વર વિદેશમાં હોય તો તેની સામે ભારત સરકાર

કોઈ પગલાં ભરી શકતી નથી. ભારતના કાયદા વિદેશની ભૂમિ પર કામ કરતા નથી.

બસ આ જ વાત રાજ કુન્દ્રા સારી પેઠે જાણતા હતા. તેથી તેમણે લંડનમાં તેની એપને લોન્ચ કરવા માટે અલગ કંપની ખોલી હતી. તેનું સંચાલન તેનો સાળો જ કરતો હતો. રાજ કુન્દ્રા પણ તેમાં ભાગીદાર હતો. મોટાભાગના વેપારીઓ પોર્ન ફિલ્મોનું નિર્માણ પોતે કરતા નથી. પરંતુ નાના નિર્માતાને તે કામ સોંપી દે છે. રાજ કુન્દ્રા પોતે શોષીન હોવાથી તેણે નિર્માણનું કામ પોતાના હાથમાં રાખ્યું હતું. રાજકુન્દ્રા પોતે જ યુવતીઓનું ઓનલાઈન ઓરિજન લેતો હતો. જેમાં તેને સ્ક્રીન ટેસ્ટના નામે કપડાં ઊતારવાનું કહેવામાં આવતું હતું. જે યુવતીઓ કેમેરા સામે કપડાં ઊતારવામાં સંકોચ ન અનુભવે તે પોર્ન ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ જશે, તેવું

પોતે જ યુવતીઓનું ઓનલાઈન ઓરિજન લેતો હતો. જેમાં તેને સ્ક્રીન ટેસ્ટના નામે કપડાં ઊતારવાનું કહેવામાં આવતું હતું. જે યુવતીઓ કેમેરા સામે કપડાં ઊતારવામાં સંકોચ ન અનુભવે તે પોર્ન ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ જશે, તેવું

વિદેશોમાં જેમ પોર્નસ્ટારોનું કલ્ચર વિકસ્યું છે. તેમ ભારતમાં પણ તેવું કલ્ચર વિકસી રહ્યું છે.

પૂનમપાંડે, શેલિન ચોપરા અને ગહેના વશિષ્ઠનાં નામો પોર્ન માટે જાણીતા બની ગયાં છે. તેમનો ચહેરો જાણીતો હોવાથી તેમને એક ફિલ્મમાં કામ કરવાના રપથી ૩૦ લાખ રૂપિયા મળે છે. નવોદિત સ્ત્રીઓ રપ હજાર રૂપિયામાં પણ કામ કરવું પડે છે. આ યુવતીઓની ડિમાન્ડ કોલગર્લના બજારમાં પણ વધી જાય છે. ભારતમાં મુંબઈ શહેર બોલિવૂડની જેમ પોર્નો ગ્રાફીઉદ્યોગનું પણ હેડ ક્વાટર્સ બની ગયું છે, તેમાં કોઈ શંકા નથી. આ ઉદ્યોગ ધમધમે છે તે માટે પોલીસને પણ મોટાપાયે સાલિયાણુ અપાઈ રહ્યું છે. મુંબઈ પોલીસે ગયા ફેબ્રુઆરી મહિનામાં મઠ ટાપુ પર દરોડો પાડ્યો હતો, જે કેસની તપાસમાં રાજ કુન્દ્રાનું નામ બહાર આવ્યું હતું. મુંબઈ પોલીસે રાજ કુન્દ્રા સુધી પહોંચતા ૬ મહિના કેમ લાગ્યા? તે સવાલ પણ વિચારવા જેવો છે.

રાજ કુન્દ્રાના સહયોગીના દાવા મુજબ તેણે ધરપકડથી બચવા મુંબઈ પોલીસને રપ લાખ રૂપિયાની લાંચ પણ આપી હતી. કદાચ વધુ રકમ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા હાલ જેલમાં જ છે. મેટ્રોપોલિટન કોર્ટે તેના જામીન ફગાવી દીધા છે. બીજી તરફ સેબીએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા તથા તેમની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝ સામે ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોના ભંગ બદલ ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ એક અન્ય ઘટનાક્રમમાં એક મોડેલે રાજ કુન્દ્રા, ગહેના વશિષ્ઠ અને અન્ય ચાર પ્રોડ્યુસર્સ સામે અશ્લીલ ફિલ્મોમાં કામ કરાવવા મુદ્દા મલાડ ખાતે ફરિયાદ દાખલ કરાવી છે. મોડેલને વેબ સિરીઝમાં કામ આપવાનું કહીને અશ્લીલ ફિલ્મો કરાવવામાં આવી હતી.

પોર્ન ફિલ્મ કેસમાં કાઈમ બ્રાન્ચ દ્વારા કુન્દ્રાને કોર્ટમાં રજૂ કરવા દરમિયાન કેટલાક ડિજિટલ ડેટા પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. કાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, રાજ કુન્દ્રા સામેની તપાસ દરમિયાન તેમને એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મળ્યું હતું જેમાં તેની કંપનીના ફ્યૂચર પ્લાન બતાવવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે, રાજ કુન્દ્રા પોતાની એપ અને પોર્ન ફિલ્મ કંપનીની રેવન્યૂને દોઢ અબજ સુધી લઈ જવા માગે છે. તેના દ્વારા તેણે વર્ષે ૩૦ કરોડના પ્રોફિટની પણ આશા રાખી હતી.

રાજ કુન્દ્રાએ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીના નાણાકીય વર્ષનો રેવન્યૂ અને પ્રોફિટને પ્લાન તૈયાર કરી લીધો હતો. મુંબઈ કાઈમ બ્રાન્ચનું કહેવું છે કે આ કેસમાં અભિનેત્રી શેલિન ચોપરાને સાક્ષી બનાવવામાં આવી રહી છે.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES



CANADA IMMIGRATION

Specialized in :

**Job Offer & LMIA / Entrepreneur /
Investor Business/ Self Employed /
Farm Investor**

- LMIA/WORK PERMIT
- EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS / DETENTION REVIEWS /
CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS



AMI MEHTA

IMMIGRATION PRACTITIONER

**BUSINESS IMMIGRATION
TO CANADA REQUIRES
3 CR NET WORTH/
1.5 CR INVESTMENT/
BUSINESS OWNERSHIP/
MANAGEMENT EXP**

**REJECTION
CASES SPECIALIST**

**ONLINE IELTS
SPOKEN ENGLISH
CLASSES ON ZOOM**

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE
/ PR 90 DAYS INSURANCE**

CANADA

**94- 499 MAIN STREET SOUTH, SHOPPERS WORLD MALL,
BRAMPTON, ONT. PH : 416-745-2466, 905-230-7855**

VADODARA

**101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri,
Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817**

AHMEDABAD

**139 Iscon Emporio, Beside Star Bazaar Satellite
Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911**

Email.: info@siis.ca

Website.: www.siis.ca

હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન : 1 ઓગસ્ટે અંતિમ ક્રિયા

સ્વામીજીને 27 જુલાઈએ સોખડા હરિધામથી ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, 1 લાખની વધુ ભક્તોએ દર્શન કર્યા

હરિપ્રસાદ સ્વામીની જીવન ઝરમર



- સ્વામીજીનો જન્મ 1934ના રોજ વડોદરાના આસોજ ખાતે થયો હતો
- પૂર્વાશ્રમનું નામ પ્રભુદાસ પટેલ હતું
- દસ વર્ષ સુધી યોગીજી મહારાજના સેક્રેટરી તરીકે સેવા આપી હતી
- 1965માં વિજયાદશમીના દીને યોગીજી મહારાજે ભાગવતી દીક્ષા આપીને હરિપ્રસાદ નામ આપ્યું
- સંજોગોવસાત 1966માં અક્ષરપુસ્તકોત્તમ સંસ્થાથી અલગ થવાનું થયું
- 1971માં પોતાના યુગકાર્યનો પ્રારંભ કર્યો
- દાસત્વ ભક્તિનો પાઠ અનુયાયીઓને શીખવ્યો
- યોગી ડીવાઈન સોસાયટીની સ્થાપના કરી અનેક કાર્યો કર્યા
- અનેક વિદ્યાધામોના સર્જન કરી શિક્ષણ માટેનો મહાયજ્ઞ કર્યો
- હરિપ્રસાદ સ્વામીજીના પ્રાગટ્ય દિનને આત્મીય પર્વ તરીકે મનાવાય છે
- હરિપ્રસાદ સ્વામી આત્મીયતાના અનોખા આચાર્યક હતા

વડોદરા

વડોદરા નજીક સોખડા ખાતે સ્વામિનારાયણ મંદિર હરિધામ અને યોગી ડીવાઈન સોસાયટીના સ્થાપક પૂ.હરિપ્રસાદ સ્વામીજી સોમવારે રાત્રે ૧૧ વાગ્યે ૮૭ વર્ષની વયે બ્રહ્મલીન થયા બાદ હજારો ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. હરિપ્રસાદ સ્વામીને ફેબ્રુઆરી માસથી કિડનીની બીમારી હતી અને આ જ બીમારી તેમની વિદાયનું કારણ બની હતી. ૨૫ જુલાઈએ ડાયાલિસિસ બાદ તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી. તેમને ૨૬ જુલાઈએ સાંજે સોખડા હરિધામથી ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ રાત્રે ૧૧



વાગ્યે બ્રહ્મલીન થયા હતા. આ ખબર વાયુવેગે હરિભક્તોમાં પ્રસરી ગઈ હતી અને સવાર સુધીમાં તો હોસ્પિટલની બહાર હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ઘણા ભાવિકો ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. બપોરે તેમના

પાર્થિવ દેહને સોખડા હરિધામ મંદિર ખાતે લઈ જવાયો હતો. હરિધામ ખાતે ફૂલોની ચાદર બિછાવવામાં આવી હતી. ગોરવાથી હરિધામ સુધીના રસ્તા પર હજારો ભાવિકો પણ દર્શન માટે ઉભેલા જોવા મળ્યા હતા. હરિધામના કોઠારી સ્વામી પ્રેમસ્વરુપદાસજીના કહેવા પ્રમાણે હરિપ્રસાદજીની અંતિમ ક્રિયા ૧ ઓગસ્ટે બપોરે ૨-૩૦ વાગ્યે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન ભક્તો કરી શકે તે માટે મંગળવારથી ચાર દિવસ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અલગ-અલગ પ્રદેશના ભાવિકો ૩૦ જુલાઈ સુધી સવારે ૮ થી રાત્રીના આઠ વાગ્યા સુધી દર્શન કરી શકે તે માટે શિડયુલ પણ બહાર પાડવામાં આવ્યું હતું.

હરિપ્રસાદજીના દર્શન માટે લાંબી ક્તારો લાગી



હરિપ્રસાદજી બ્રહ્મલીન થયાની ખબર વાયુવેગે ફેલાતા ભક્તો શોકમગ્ન થઈ ગયા હતા. છેલ્લા 4 દિવસમાં 1 લાખની વધુ ભક્તોએ અંતિમ દર્શન કર્યા હતા.

પૂર્વાશ્રમમાં પ્રભુદાસભાઈ તરીકે ઓળખાતા હતા

દીક્ષા પહેલા હરિપ્રસાદજી ૧૦ વર્ષ યોગીજી મહારાજના સેક્રેટરી રહ્યા

સોખડા : હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ ૨૩ મે, ૧૯૩૪ના રોજ વડોદરા જિલ્લાના આસોજ ખાતે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ પ્રભુદાસભાઈ હતું. ૧૯૫૫ થી ૧૯૬૫ સુધી તેમણે બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજના સેક્રેટરી તરીકે સેવા આપી હતી. પાંચ બહેનો વચ્ચે એક જ ભાઈ એવા પ્રભુદાસ ભાઈને ગુરુહરિ યોગીજી મહારાજે ૧૯૬૫માં દશેરાના દિવસે પાર્થદી અને શરદપૂનમના દિવસે ભાગવતી દીક્ષા આપીને હરિપ્રસાદ સ્વામી નામ આપ્યું હતું. દીક્ષા આપવા માટે યોગીજી મહારાજે ખાસ યજ્ઞ પણ કર્યો હતો. હરિધામ સોખડાના સંતોના કહેવા પ્રમાણે સોખડામાં ત્રણ શિખરનું ભવ્ય મંદિર બનશે તેવા આશીર્વાદ પણ તેમને યોગીજી મહારાજે જ આપ્યા હતા. યોગીજી મહારાજના આશીર્વાદ સાથે તેઓ ૧૯૬૬માં અક્ષર પુસ્તકોત્તમ સંસ્થાથી અલગ પડ્યા હતા અને ૧૯૭૧થી હરિપ્રસાદ સ્વામીજીએ પોતાના કાર્યનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે તેની સુવર્ણ જયંતિની ઉજવણી થઈ રહી છે.

હરિપ્રસાદ સ્વામી તો સેવા, ભક્તિ અને સમર્પણના શ્રેષ્ઠ ઉદાહરણ હતા : મોદી

નવી દિલ્હી: પીએમ મોદીએ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોક સંદેશમાં સ્વામીજીને સેવા, ભક્તિ અને સમર્પણના શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યા છે. સાથે જ કહ્યું કે, ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ વિદેશના લાખો અનુયાયીઓના જીવનમાં પરિવર્તન લાવવા સેતુ રૂપ બન્યા છે. વિચાર દર્શનનું પ્રતિક એવું સોખડા હરિધામ પ્રેરણા તીર્થધામ બન્યું છે. સ્વામીજીના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળ્યો છે. પ્રધાનમંત્રીએ હરિપ્રસાદ સ્વામી મહારાજની આત્માને શાન્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. દરમિયાન આજે



અખિલ ભારતીય સંત સમિતિના સંગઠન મંત્રી વેદાંત કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ધર્મ આચાર્ય ઋષિ ભારતીએ આજે હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. નોંધપાત્ર કામ કર્યું છે. આત્મીય ઋષિ ભારતી જૂનાગઢ અને શબ્દ દ્વારા હરી ભક્તો સુધી સરખેજ આશ્રમના ગાદીપતિ પહોંચ્યા છે.

દહેજ પ્રથા, ભૃષ હત્યા રોકવા અને યુવકોને વ્યસનમુક્ત કરવા નેત્રંગમાં મંદિર બનાવ્યું

ભરૂચ : યોગી ડીવાઈન સોસાયટીના પ્રણેતા અને યોગીજી મહારાજના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજી આદિવાસી વિસ્તારના લોકો માટે પણ પથદર્શક રહ્યા છે. સમાજમાં ચાલતી દહેજ પ્રથા, સ્ત્રીભૃષ હત્યા, યુવકો વ્યસનમુક્ત બને, કુટુંબીવાજો નાબુદ થાય અને સત્સંગસભામાં જોડાઈને દાસના દાસ બને તેવા સંદેશ સાથે હરિપ્રસાદ સ્વામીજી સન ૧૯૮૫ની આસપાસ ભરૂચ જિલ્લાના પછાત વિસ્તારમાં આવેલા નેત્રંગ ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે પોતાની ગાડીમાં ઈંધણ નાખવા માટે પેટ્રોલપંપ

ઉપર ઉભા રહ્યા હતા. એકાએક તેમની મુલાકાત શકુર પઠાણ સાથે થઈ હતી. ત્યારે હરિપ્રસાદ સ્વામીએ શકુર પઠાણને જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં ભગવાન સ્વામીનારાયણની સત્સંગ સભા કરવા માંગીએ છીએ, આપના સહકારની જરૂર છીએ. જે બાદ હરિપ્રસાદ સ્વામીએ પોતાની પહેલી સત્સંગસભા નેત્રંગમાં કરી હતી. આ સમયે નેત્રંગમાં હરિધામ સોખડા જેવા મંદિર બનાવાનો સંકલ્પ કર્યો હતો. મંદિર બન્યા બાદ સવાર-સાંજ આરતી અને હરીભક્તોની ઉપસ્થિતમાં સત્સંગસભા થવા માંડી હતી.

DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Gratitude Program

Every Thursday 9 PM

Join today on-ZOOM!

: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta



વિસનગર બેઠકમાં મતદાન બાબતે ઝઘડાના કેસમાં 17 ઈસમોને સજા થઈ: 21 નિર્દોષ

મતદાન સમયે થયેલી મારામારીમાં એક ઈસમે આંખ ગુમાવી હતી અને દર-દાગીના લૂંટાયા હતા

વિસનગર
વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં વિસનગર વિધાનસભા સીટના હસનપુર ગામમાં મતદાન બાબતે બે સમાજ વચ્ચે જુથ અથડામણ થઈ હતી. આ જુથ અથડામણમાં લાકડી, ધોક્કા, હથિયારો તથા પથ્થરમારાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઠાકોર યોગેશજી જુજારજીએ કુહાડીથી હુમલો કરતા પટેલ ભગવાનભાઈ પ્રહલાદભાઈએ આંખ ગુમાવી હતી. જેમની દુકાનના ડ્રોઅરમાંથી

રૂ.૧૨૦૦૦ ની લુંટ થઈ હતી. મતદાન કરવા ગયેલા પટેલ નીતાબેન કિરીટકુમારે પહેરેલ રૂ.૫૦,૦૦૦ ની કિંમતના અઢી તોલાના મંગળસુત્રની તેમજ નવીનભાઈ મગનલાલ પટેલે પહેરેલ બે તોલાના દોરાની અને તેમના ખીસ્સામાંથી રૂ.૧૫,૦૦૦ રોકડની લુંટ થઈ હતી. આ અથડામણમાં બન્ને જુથના થઈ ૨૪ ઈસમોને ઈજા થઈ હતી. જુથ અથડામણના આ કેસમાં ૧૭ આરોપીઓને સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. અને ૨૧ને

નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. સજા પામેલ આરોપીમાં ઠાકોર યોગેશજી, ઠાકોર ધુળાજી, ઠાકોર સંજયજી, ઠાકોર દિનેશજી, ઠાકોર સુરેશજી, ઠાકોર નટવરજી, ઠાકોર વદાજી, ઠાકોર અમિતજી, ચૌહાણ રાજેન્દ્રસિંહ, ઠાકોર ગોપાળજી, ઠાકોર રતનજી, ઠાકોર રજુજી, ઠાકોર મહેન્દ્રજી, ઠાકોર ભાદરજી, ઠાકોર કમલેશજી, ઠાકોર દશરથજી, ઠાકોર અભુજીને બે વર્ષની સજા તેમજ દંડનો હુકમ કરવામાં આવ્યો છે

વજુભાઈની ભાજપમાં સક્રિય થવાની જાહેરાત: રાજપૂતો માટે મંદિર બનાવશે

રાજકોટ
કર્ણાટક રાજ્યપાલ તરીકે તા.૧-૯-૨૦૧૪થી ગત તા.૬-૭-૨૦૨૧ સુધી રહેલા ૮૩ વર્ષના જનસંઘ વખતના પીઠ રાજકારણી વજુભાઈ વાળા હવે તેમના વતન રાજકોટમાં સ્થાયી થયા છે. આજે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે તેઓ પહેલેથી ભાજપમાં છે, હતા અને રહેશે અને ગુજરાતની આવનારી ધારાસભાની ચૂંટણીમાં તેઓ પાર્ટી માટે તનતોડ મહેનત કરશે. વિજય રૂપાણી કે વ્યક્તિગતને નહીં પણ પાર્ટી કહેશે તે ઉમેદવાર માટે પૂરી મહેનત કરવાની જાહેરાત કરી કહ્યું, ‘ભાજપમાં હોતો, છું અને રહીશ’ આ ઉપરાંત કારડીયા,ભાટી,ગુર્જર

સહિત સમસ્ત રાજપૂત સમાજની એકતા પર ભાર મુક્યો હતો અને આ માટે ભવાની માતાજીનું મંદિર વસ્તીમાં ૨૦ એકર જમીનમાં બનાવવા નિર્ણય પણ જાહેર કર્યો હતો. રાજકોટના રહેવાસી એવા મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે પ્રચારકાર્ય સંભાળશે તે સવાલના ઉત્તરમાં તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે તેઓ વિજયભાઈ કે અન્ય કોઈ વ્યક્તિગત નહીં પણ પાર્ટી કહેશે તેમના માટે પૂરા દિલથી કામ કરશે. તેઓ હરીફ ઉમેદવાર કે પક્ષ પર કોઈ આક્ષેપો કરવાને બદલે માત્ર ભાજપની જ વાત કરવાનું વલણ રાખશે તેમ ઉમેર્યું હતું.

વિસાવદર પાલિકામાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો

જૂનાગઢ:વિસાવદર નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દસ સભ્યો દ્વારા ભાજપ શાસીત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્તને અંગે નગરપાલિકાના પ્રમુખ દ્વારા સોમવારે નગરપાલિકાના સભાખંડમાં વિશ્વાસનો મત મેળવવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના સભ્યો હાજર રહ્યા હતા. પરંતુ દરખાસ્ત મુકનાર કોંગ્રેસના સભ્યો જ ગેરહાજર રહ્યા હતા અને અવિશ્વાસની મુકવામાં આવેલી દરખાસ્તનું સુરસુરીયું થઈ ગયું હતું. જેથી ભાજપ પોતાનું શાસન જાળવવામાં સફળ રહ્યું હતું.

CPCB દ્વારા વિશ્વામિત્રીનો સર્વે કરી 4.82 કરોડના ખર્ચે DPR તૈયાર કરાશે

પાવાગઢ
પાવાગઢથી નીકળીને ખંભાતના અખાતમાં ભળી જતી વિશ્વામિત્રી નદીનો સર્વે કરાશે અને ડીટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરાશે. જે પાછળ મ્યુનિ. કોર્પોરેશન રૂ. 4.82 કરોડનો ખર્ચ કરાશે. જેમાં લેન્ડ રેકોર્ડ ડીજીટલાઈઝેશન અને નદી હદ નિયત કરવા સહિતની કામગીરી કરાશે. આ કામે મંજૂરી માગતી દરખાસ્ત સ્ટેનિંગ કમિટિ સમક્ષ રજૂ કરાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ગત તા. 20-12-2019ના રોજ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન

કરાયુ હતું. વિશ્વામિત્રીને પુનઃ જીવંત કરવાની દિશામાં સરકારે ગંભીરતા લીધી છે ત્યારે પાવાગઢથી નીકળીને ખંભાતના અખાત સુધીની વિશ્વામિત્રીનો સર્વે કરાશે અને ડીટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરાશે. સરવેમાં લેન્ડ રેકોર્ડ ડીજીટલાઈઝેશન, નદીની હદ નિયત કરવી, હાલ અંડર ગ્રાઉન્ડ અને ઓવર ગ્રાઉન્ડ સર્વિસ લાઈનો કેટલી છે? તેનો ડેટા એકત્રીત કરાશે તેમજ સોઈલ ઈન્વેસ્ટિગેશન સર્વે કરી રીપોર્ટ તેમજ નદીમાં પૂર સંબંધીત કામગીરી અને હાઈડ્રોલિક સર્વે કરાશે. વડોદરાને પૂરથી બચાવવા શું

કામગીરી કરી શકાય? તેમજ નદીના પ્રવાહનું શુદ્ધિકરણ, પુનર્જીવન અને નદી સંબંધીત પ્રદૂષણ નિયંત્રણની કામગીરી, પ્રોજેક્ટ માટેનો ખર્ચ, આવક અને નિભાવણીનો ખર્ચ સહિતનો અંદાજ તૈયાર કરવા, ઝૂપડપટ્ટી પુનઃવસન માટે ઉપાય સૂચવવા, સોલર એનર્જી, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને વૃક્ષારોપણ સહિતની કામગીરી દર્શાવશે. તેમજ પરામર્શ પ્રોજેક્ટ રીપોર્ટ, સૂચિત અને અંતિમ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરાશે. જેમાં પર્યાવરણીય અસર મૂલ્યાંકન અને પર્યાવરણીય મજૂરી તથા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી પણ લેવાશે.

હાઈકોર્ટમાં વિચિત્ર કેસ: વહુની નોકરી રદ કરાવવા સાસુની અરજી

અમદાવાદ
વહુને સરકારી નોકરીમાં મળેલી નિમણૂકને રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને બુધવારે હાઈકોર્ટે ફગાવી દીધી છે અને અરજદાર સાસુને રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે અરજી ફગાવતા અરજદારના વકીલને ટકોર કરી હતી કે, ‘તેમણે આ પ્રકારની અરજી ક્યારેય જોઈ નથી, આ ખરેખર અદ્ભૂત લાગે છે.’ હાઈકોર્ટે નોંધ્યું છે કે, ‘આ અરજીમાં વિચિત્ર અને બિનજરૂરી માગ કરવામાં આવી છે. જેમાં, વહુને સરકારી નોકરીમાં મળેલી નિમણૂકની

માગ એક સાસુ દ્વારા કરાઈ છે. અરજદાર સાસુએ આ પ્રકારની અરજી તેનો અંગત બદલો લેવા માટે કરેલી હોય તેવું લાગે છે. અરજદાર સાસુ અને તેની વહુ વચ્ચેનો સિવિલ પ્રકારનો વિવાદ પડતર છે. આ કેસમાં નવાઈની વાત તો એ છે કે, વકીલ દ્વારા અરજદારને આ પ્રકારની અરજી કરવા માટે પ્રોત્સાહિત કરાયા છે અને તેને સલાહ આપવામાં આવેલી છે. અરજદારે, આ પહેલા અન્ય કોઈ ફોરમ સમક્ષ ગયા નથી અને સીધા હાઈકોર્ટમાં અરજી કરી છે. આ પ્રકારની અર્થહીન અરજીથી હાઈકોર્ટ અને તેના સ્ટાફનો સમય બગડ્યો છે.

હળવદમાં મામા - ફોઈના બે ભાઈઓએ ઝેરી દવા પી લેતા મોત

હળવદ: હળવદના શિરોઈ ગામના ખીણ વિસ્તારમાં બે યુવાનોના મૃતદેહો પડ્યા હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તપાસમાં મૃતક યુવાનો હળવદ ખારીવાડી વિસ્તારમાં રહેતા હિતેશભાઈ પ્રેમજીભાઈ બાબરીયા ઉ.વ.૨૮ અને નવા શિરોઈ ગામે રહેતા લાલાભાઈ પોપટભાઈ પાટડીયા ઉ.વ.૨૮ હોવાનું બહાર આવ્યું છે. વધુમાં બન્ને યુવાનોએ ઠંડા પીણામાં ઝેરી દવા મિલાવી પી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

સંક્ષિપ્ત સમાચાર

ડાકોરમાં હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો



ડાકોરમાં હિંડોળાનો પ્રારંભ થયો છે. ઠાકોરજીને કેસરનો એક ભોગ વધુ ધરાવવામાં આવ્યો હતો. ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો આજે હિંડોળાદર્શન માટે ઉમટ્યા હતા. આજથી એક માસ સુધી ગોપાલલલાજીને વિવિધ પ્રકારના સુશોભિત હિંડોળામાં ગુલાવવામાં આવશે. તિલક કરીને ગોપાલલલાજીને હિંડોળે બેસાડવામાં આવ્યા હતા.

વિરપુરમાં ગુરૂપૂર્ણિમા બાદ જલારામ બાપાના મંદિરનું મુખ્ય દ્વાર ભાવિકો માટે ખુલ્લું મૂકાયું

વિરપુર- સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામબાપાની જગ્યા પણ દર્શનાર્થીઓ માટે ૨૧ માર્ચ ૨૦૨૦થી બંધ કરવામાં આવી હતી. બીજી લહેર બાદ શ્રદ્ધાળુઓ માટે જલારામબાપાની જગ્યા દર્શન માટે ખોલવામાં આવ્યું હતું. ગુરૂ પૂણમાં પાવન અવસરે ભાવિકો માટે મુખ્ય દ્વાર ખુલ્લો મુકાયો છે ત્યારે ભાવિકોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જલારામ મંદિરમાં સેવા કરતા રમેશભાઈ ગઢીયાએ જણાવ્યું હતું કે, ૧૬ મહિના પછી દર્શનાર્થીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યો છે. દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ રાખી, પહેરી તથા ગાઈડલાઈન પ્રમાણે રવિસ્ત્રેશન કરી ટોકન મેળવી અને દર્શન કરવા આવવા જણાવાયું છે.

વડતાલધામ - સંતરામ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની સાદગીપૂર્ણ ઉજવણી: ભક્તો ઊમટી પડ્યા



નડિયાદ : સંતરામ મંદિર અને વડતાલધામમાં ગુરૂપૂર્ણિમાની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને ધાર્મિક સ્થળો પર મર્યાદિત આયોજનો જોવા મળ્યાં હતાં. વડતાલધામમાં સવારે મંગળા આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પાઠુકા પૂજન કરીને આરતી ઊતારી હતી. આ પ્રસંગે વચનામૃત-હિન્દી, દિવ્ય મહાપૂજા, મંત્રપોથી, સત્સંગિજીવન, સાગરમંથન, શિક્ષાપત્રી એવં નિત્ય નિયમ વગેરે પાંચ પુસ્તકોનું વડીલ સંતો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. સંતરામ મંદિરમાં ગુરૂપાઠુકા પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

વડોદરા: સિંધરોટના મહીસાગર નદીમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહો મળી આવ્યા

વડોદરા: વડોદરા શહેર નજીક સિંધરોટ મહીસાગર નદીમાં નવા નવા પાણી આવતા બે કાંઠે વહી રહી છે તેવા સમયે આનંદ તાલુકાના નાપાડ ગામનો યુવક યુવતી યુવતી સાથે બાઈક ઉપર સિંધરોટ નજીક મહીસાગર બ્રિજ પર આવી પહોંચ્યા હતા અને તેઓએ બ્રિજની નજીક આવેલ મકાઈની લારી પાસે બાઈક ઉભી રાખી ને ચાલતા થોડેક દૂર ગયા હતા જ્યાં આ બંને રહસ્યમય સંબોગમાં ઘસમસતા વહેતા મહીસાગર નદીના પાણીમાં મોતની છલાંગ લગાવી હતી જેથી તેઓ મોતને ભેટ્યા હતા આ બંનેની લાશ મહીસાગર નદીના કિનારે તરતી લોક નજરે ચડતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કિનારા પર તરતી લાશોને બહાર કાઢી હતી.

સોલા ઉમિયા કેમ્પસમાં 1500 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સાકાર કરવા પાટીદારોનો નિર્ણય

અમદાવાદ: સોલા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટ અંગે પાટીદારોની યોજાયેલી બેઠકમાં આગેવાનો દ્વારા અનેક પાસાની ચર્ચા કરવામાં આવી હતી. જો કે, આ બેઠકમાં રાજકીય મુદ્દે કોઈ ચર્ચા થઈ ન હતી. પરંતુ સંસ્થાના આગામી આયોજનોને ચર્ચામાં લેવાશે. અગાઉ ઉમિયા માતાજી સંસ્થાન ઊઝા દ્વારા અમદાવાદ સોલા કેમ્પસમાં 74000 ચોરસ વાર જમીનની ખરીદી કરાઈ હતી. તેથી આ જમીનમાં હવે ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા બુદ્ધિ-બુદ્ધિ વિભાગોનું નિર્માણ કરવાનો મુદ્દો બેઠકમાં કેન્દ્ર સ્થાને રહ્યો હતો. બેઠક પહેલાં આગેવાનોએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રોજેક્ટ પાછળ 1500 કરોડનો ખર્ચ થશે.



પોલીસ ગોળીબારથી મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું લોહીલુહાણ - મસ્તક થાળીમાં મૂકી વકીલોને બતાવ્યું

કોંગ્રેસ હાઉસની ડાઉસવામાં આવેલી ગોળીઓના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓનું લોહી રેડાયું. પોલીસના ગોળીબારથી બનાસકાંઠાથી આવેલા પૂનમચંદ નામના એક વિદ્યાર્થીની ખોપડી ઊડી ગઈ. તે ખોપડીના માંસના લોચા એક થાળીમાં મૂકી કેટલાક વિદ્યાર્થીઓ કોંગ્રેસ ભવનની નજીક આવેલી વકીલોની ગુજરાત ક્લબમાં પહોંચી ગયા. પોલીસે છોડેલી શ્રી નોટ શ્રી ગોળીથી ઊડી ગયેલું વિદ્યાર્થીનું લોહીલુહાણ મસ્તક જોઈ વકીલોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો.

ગોળીબારમાં કૌશિક ઈન્દુભાઈ વ્યાસ અને સુરેશ જયશંકર ભટ્ટ પણ શહીદ થયા. કૌશિક સેટ ઝેવિયર્સનો વિદ્યાર્થી હતો. આ જ સ્થળે અબ્દુલ પીરભાઈ નામનો યુવાન પણ ગોળીથી શહીદ થયો. ઉશ્કેરાયેલા વકીલો કોંગ્રેસ ભવન પહોંચી ગયા અને કોંગ્રેસીઓને પૂછ્યું : 'કોના હુકમથી ગોળીઓ છોડાઈ ?' શહેર કોંગ્રેસના આગેવાનો પાસે કોઈ માહિતી કે જવાબ નહોતો. આ ઘટના બાદ મહાગુજરાત આંદોલનની હિંસક જવાબ આપ્યા ગુજરાતમાં ફેલાઈ ગઈ. આ ગોળીબારે નોંધપાત્ર સ્થિતિ એ પેદા કરી કે હિંદુ અને મુસલમાનોના એક જ સ્થળે લોહી રેડાતા મહાગુજરાતના આંદોલનમાં હિંદુ-મુસલમાનો વચ્ચે સ્વયંભુ એકતાનું હવામાન ઊભું થયું.

૧૦મી ઓગસ્ટ

ગોળીબારના વિરોધમાં મ્યુનિસિપલ કોર્પોરેટર પુરુષોત્તમ બ્રહ્મભટ્ટ ઈંકણીવાળાએ રાજીનામું આપ્યું. તમામ કોલેજના પ્રતિનિધિઓની સભા બપોરે મળી અને આંદોલનને ગામડાં સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. એડવોકેટ બકુલ જોષીપુરાએ 'ગલી ગલી મેં ગુંજે નાદ' નામની પુસ્તિકા તૈયાર કરી. ઈન્દુલાલ યાજ્ઞિકે આ આંદોલનને વધાવી લીધું. 'ગલી ગલી મેં ગુંજે નાદ' અમારે જોઈએ મહાગુજરાત અને 'મહાગુજરાત લે કે રહેંગે'ના નારા શરૂ થયા. વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ અમદાવાદની ચિંતા વ્યક્ત કરી અને જાહેર કર્યું કે ભાષાના ધોરણે દેશના ટુકડા થાય તે યોગ્ય નથી. જે કંઈ બન્યું છે તે ચિંતાજનક છે. આ જ દિવસે સિવિલ હોસ્પિટલ બહાર પેશાબ કરવા બેઠેલા બે મુસ્લિમ યુવાનો ઉપર ગોળીબાર કરતાં બંને ઢળી પડ્યા. રાયપુર દરવાજા બહારની પોલીસ ચોકી સળગાવી દીધી. મુંબઈથી ડી. આઈ. જી. નગરવાલા આવી પહોંચ્યા. દિવસ દરમિયાન શહેરમાં ૧૦ ગોળીબાર થયા. બેનાં મરણ થયાં. ૪૩૦ માણસોની ધરપકડો થઈ.

૧૧મી ઓગસ્ટ

મુંબઈથી કે. કે. શાહ, બાબુભાઈ ચિનાઈ અને નાયબ કેળવણી પ્રધાન ઈન્દુમતીબહેન શેઠ અમદાવાદ આવ્યાં. તેઓએ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓને સમજાવવા પ્રયત્નો કર્યા. અમદાવાદના મેયર ચીનુભાઈ શેઠ, ડે. મેયર ચંદ્રકાંત ગાંધીએ અને કોંગ્રેસી ધારાસભ્ય જયકૃષ્ણ હરિવલ્લભદાસે પોતપોતાનાં સ્થાનો પરથી રાજીનામું આપ્યાં. સુશિક્ષિત મહિલા આગેવાનો બહાર આવ્યાં. તે પૈકી વિનોદિની નીલકંઠ, રંજનબહેન દલાલ, વીરબાળા નાગરવાડિયા, દીનબાઈ કામા, શારદાબહેન મહેતા વગેરેએ નિવેદન કરીને જણાવ્યું અમે નિર્દોષ બાળકોની મા છીએ. યુવાનોનું વધુ લોહી રેડવાનું બંધ કરો. દિવસ દરમિયાન શહેરમાં ૧૩ જગ્યાએ ગોળીબાર થયા અને ૩૨૫ લોકોની ધરપકડો થઈ.

૧૨મી ઓગસ્ટ

આંદોલન ઘરે ઘરે પહોંચ્યું.

નાનાં બાળકો પણ રટણ કરવા લાગ્યાં. 'લાઠી-ગોલી ખાયેંગે, મહાગુજરાત લે કે રહેંગે.' જાણીતા વૃત્તપત્રે લખ્યું. આ તો ગોવાવાળા પોર્ટુગીઝ કે બ્રિટિશ પોલીસથી પણ ગયા. ગાંધીજીનું નામ અને અહિંસાની આવી હાંસી ? કરોડો ગેલન પાણીથી ગોઝારા કોંગ્રેસ હાઉસને ધોશો તો પણ ગુમાવેલી પવિત્રતા ફરી પ્રાપ્ત થશે નહીં. શહેરે એક વધુ 'શહીદો અમર રહો' અને 'મહાગુજરાત જિંદાબાદ' પોકારતું કોંગ્રેસ હાઉસ તરફ ઊપડ્યું. દૂર દૂર સુધી એનો છોડો દેખાતો નહોતો. સરઘસ શાંત અને ગંભીર હતું. શહીદ સ્થળે દીવો પ્રગટાવવામાં આવ્યો. ધૂપસળી સળગાવવામાં આવી. પુષ્પાંજલિ કરવામાં આવી. સરઘસે બે મિનિટ મૌન પાળ્યું. હજારો લોકો આવ્યા



કૌશિક સેટ ઝેવિયર્સનો વિદ્યાર્થી હતો. આ જ સ્થળે અબ્દુલ પીરભાઈ નામનો યુવાન પણ ગોળીથી શહીદ થયો. ઉશ્કેરાયેલા વકીલો કોંગ્રેસ ભવન પહોંચી ગયા અને કોંગ્રેસીઓને પૂછ્યું : 'કોના હુકમથી ગોળીઓ છોડાઈ ?' શહેર કોંગ્રેસના આગેવાનો પાસે કોઈ માહિતી કે જવાબ નહોતો.

માણસનો ભોગ લીધો.

૧૩મી ઓગસ્ટ

આ દિવસને શહીદ દિન તરીકે મનાવવામાં આવ્યો. સવારે નવ વાગે ૧૦ હજાર જેટલા લોકોનું જંગી સરઘસ

અને પુષ્પાંજલિ અર્પીને ગયા. શહીદ દિનનો પડઘો લોકોમાં જબરદસ્ત પડ્યો. સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈની નનામી બાળવાના કાર્યક્રમો શરૂ થઈ ગયા. ૧૬ જેટલા કોર્પોરેટરોએ રાજીનામું આપી દીધાં.

વિસ્તરતું આંદોલન

હવે આંદોલન અમદાવાદ પૂરતું નહોતું. ગુજરાતના એકેએક શહેર અને ગામડાંમાં પહોંચી ગયું હતું. કારણ કે આ આંદોલન કોઈ વ્યક્તિનું નહોતું, કોઈ પક્ષનું નહોતું, કોઈ સંસ્થાનું કે કોઈ નેતાનું નહોતું. ગુજરાતના એકેએક ગુજરાતીના આત્મામાંથી સ્વયંભૂ પ્રગટેલું હતું.

૧૪મી ઓગસ્ટ

ચીનુભાઈ શેઠ સાથે જયકૃષ્ણ હરિવલ્લભદાસ, અમૃતલાલ હરગોવિન્દાસ શેઠ, રતિલાલ નાથાલાલ શેઠ, હીરાભાઈ શેઠ, ઠાકોરભાઈ મુન્સી વગેરે મિલમાલિકો શહેરની પોળોમાં ફર્યા અને શાંતિથી લડત ચલાવવા વિનંતી કરી. પાર્લમેન્ટના સભ્ય એન. સી. ચેટરજી અમદાવાદ આવ્યા અને એમણે પ્રજાની ન્યાયી માગણીને ટેકો જાહેર કર્યો. હવે મહાગુજરાતની રચનાની માગનો પવન આખા ગુજરાતમાં પહોંચી ગયો. કોંગ્રેસમાં બળવો જાહેર થવા માંડ્યો. તેમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ. કડીના ધારાસભ્ય પુરુષોત્તમદાસ પટેલ અને ગંગારામ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં. મુસ્લિમ ભાઈઓએ શહીદોના માનમાં તાજિયા નહીં કાઢવાનો નિર્ણય લીધો.

૧૫મી ઓગસ્ટ

આઝાદીનું મહામૂલ્ય પર્વ પણ જનતાએ તેને શોકદિન તરીકે મનાવ્યો. ઠેરઠેર કાળા વાવટા જોવા મળ્યા, કાળાં તોરણો જોવા મળ્યાં, સ્ત્રીઓએ કાળી સાડીઓ પહેરી, સાંજે પાંચ વાગે કોલેજના મેદાનમાં મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની સભા થઈ. ગોળીબારમાં સૌ પ્રથમ મૃત્યુ પામેલા સુરેશ ભટ્ટનાં માતા સવિતાબહેનનાં હસ્તે ધ્વજવંદન થયું. તેમણે ગદ્દદ અવાજે જણાવ્યું મારા અને

મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મોત એળે ના જાય તેવી હું લોકોને વિનંતી કરું છું. આ સાંભળીને હાજર રહેલા સૌ શ્રોતાજનોનાં હૃદયમાં ગમગીની પ્રસરી ગઈ.

૧૬-૧૭ ઓગસ્ટ

૧૬મી ઓગસ્ટનો દિવસ શાંતિથી પસાર થયો. શહેરમાં મહિલા શાંતિની રચના થઈ. પદ્માબહેન જયકૃષ્ણ, અનસુયાબહેન પરીખ અને હેમલતા હેગિસ્ટે વગેરે તેમાં જોડાયાં. દિલ્હી રાજ્યસભામાં રાજ્ય પુનરચના ખરડો રજૂ થયો અને મંજૂર થયો.

૧૭મી ઓગસ્ટે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ અલગ ગુજરાત રાજ્યની રચના કરવા તાકીદે પગલાં ભરવા પ્રદેશ સમિતિને ભલામણ કરી. ત્રિકમભાઈ પટેલને ૧૨ જણાએ ટેકો આપ્યો. જ્યારે ચાર જણે વિરોધ કર્યો. ધાંસીરામની પોળમાંથી પોલીસ લોકસભાના સભ્ય ગોપાલનની ધરપકડ કરી. ૧૯૪૭માં બિહારમાં પ્રસરેલી કોમી આગના અનુસંધાનમાં પટણાની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ જે આગાહી કરી હતી, તે આજે સાચી પડી. એવી નોંધ વૃત્તપત્રમાં જાહેર થઈ. તે પ્રમાણે હતી -- 'હું કદી જીવું કે ના જીવું, આટલાં વર્ષોના અનુભવોના આધારે આગાહી કરવાની હિંમત કરું છું કે આ દેશમાં બળવો ફાટશે, ધોળી ટોપીવાળાને પ્રજા વીણી વીણીને મારશે અને કોઈ ત્રીજી સત્તા તેનો લાભ લેશે.'

આજે તે કેટલું સત્ય લાગે છે. આજે શહેરમાં ધોળી ટોપીવાળો ઘર બહાર નીકળી શકતો નથી. કોંગ્રેસીઓએ દ્રોહ કર્યો છે એવું વાતાવરણ ઊભું થયું હતું.

દેવેન્દ્ર પટેલ

સંપર્ક

+91 98792 07102

જાણવા જેવું

સમુદ્રમાં તરતું સોનું : એમ્બરગ્રીઝ



જહાજનો ભૂકો બોલાવી ફર્નિચર અને રાસરચીલા સાથે ગળી જાય. વેલને આ બધું પચે નહીં એટલે ઉલટી કરીને બહાર કાઢે તેની સાથે તેના પેટમાંથી વધારાના કેટલાક દ્રવ્યો પણ બહાર આવે. સ્પર્મ વેલ ઉલટી કરે ત્યારે મીણ જેવો નરમ અને સોનેરી પદાર્થ બહાર આવે છે. આ પદાર્થને એમ્બર કહે છે. દરિયામાં એમ્બરના ગહા તરતા જોવા મળે. જાણકાર નાવિકો તેને ઓળખી શકે.

જમીનમાંથી ખનીજ સ્વરૂપે સોનું, હીરા અને ચાંદી જેવા કીમતી પદાર્થો મળે, દરિયામાં સાચા મોતી મળે છે. દરિયામાં જતાં જળચરોના શરીરમાં ઘણા કીમતી પદાર્થ બનતા હોય છે. એમ્બરગ્રીઝ પણ આવો જ કીમતી પદાર્થ છે. દરિયાની સપાટી પર તે તરતો જોવા મળે છે. કદાવર વેલ દરિયામાંથી જે મળે તે પેટમાં પધરાવે.

બ્રહ્માંડ કિરણો એટલે શું? તે ક્યાંથી આવે છે?

બ્રહ્માંડ અનેક રહસ્યોથી ભરેલું છે. તેમાં અસંખ્ય તારા, સૂર્યો, લઘુગ્રહો, બ્લેકહોલ જાતજાતની પ્રક્રિયાઓ કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણી શક્તિ, ગરમી અને પ્રકાશ પેદા થાય છે. કેટલાક તારા નવા જન્મે છે. આ બધું થાય ત્યારે તેમાંથી વિવિધ પ્રકારની ઉર્જા પ્રોટોન કણો સ્વરૂપે બ્રહ્માંડમાં ફેલાય છે. આવા કિરણો અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણ, સુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રથી આકર્ષાઈને આગળ વધતા હોય છે અને વિવિધ સ્વરૂપ લે છે આવા કણો પૃથ્વી તરફ પણ આવે છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તેનું સ્વરૂપ બદલાય છે. આ કિરણોને કોસ્મિક રેજ કે બ્રહ્માંડ કિરણો કહે છે. ઈ.સ. ૧૯૧૨માં ઓસ્ટ્રિયન ખગોળશાસ્ત્રીએ સંશોધનો કરીને કોસ્મિક રેજની ઉત્પત્તિ શોધી કાઢી હતી.





44 લાખ ખેડૂતોને માથે 90,695 કરોડનું દેવું

અમદાવાદ

ગુજરાતનાં કુલ 43.45 લાખ ખેડૂતો પર દેવાના બોજ નીચે ઘટાડેલા છે. જેમનું કુલ દેવું રૂ 90695 કરોડ થાય છે. એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોનાં દેવામાફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોનાં માથે સરેરાશ 20 લાખથી વધારે રૂપિયાનું દેવું છે. નાબાઈ અનુસાર દેશના 16.8 લાખ ખેડૂતોનાં માથે દેવાનો બોજ છે. દેશમાં સૌથી વધારે દેવાદાર ખેડૂતો તમિલનાડુનાં છે જ્યાં ખેડૂતોનાં માથે 1.89 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

ગુજરાતના ખેડૂતો પર 90,695 કરોડનું દેવું હોવાની વાત સામે આવી છે, બીજી બાજુ ખેડૂતોનું

દેવું માફ કરવા સરકારે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. ગુજરાતના 43.45 લાખ ખેડૂતો દેવાદાર છે. આ વિશે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેવા માફીની કોઈ યોજના નથી. પરંતુ ગુજરાત ખેડૂત સમાજની દેવા માફીની માગ ચૂંટણી ટાણે તીવ્ર બને તો નવાઈ નહીં. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર નવી નવી યોજનાઓ લોચ કરી રહી છે અને તેમની આવક બમણી કરી નાખીશું તેવા દાવા કરી રહી છે. જોકે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે, ખેડૂતોનું દેવું માફ કરવા કેન્દ્ર સરકારને સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. કેન્દ્ર સરકાર રૂ.90695 કરોડનું ખેડૂતોનું દેવું માફ નહીં કરે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે ગુજરાત ખેડૂત સમાજ સરકારના આ નિષ્ણયનો વિરોધ કરે છે. ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી શકાય તો

ખેડૂતોનું કેમ નહિ. કેન્દ્ર સરકારને ખેડૂત વિરોધી સરકાર ગણવામાં આવી હતી. ખેડૂતો દ્વારા ખેતી અને ખેડૂતને બચાવવા માટે નક્કર કામગીરીની માંગ કરવામાં આવી છે.

કોરોના વાયરસ મહામારીનાં કારણે દેશ પીડાઈ રહ્યો છે, મહામારીનાં કારણે ગરીબ અને મધ્યમ વર્ગને સૌથી વધારે નુકસાન થયું છે જ્યારે ખેતી ક્ષેત્રને પણ જોરદાર ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારને સંસદમાં પૂછવામાં આવ્યું કે શું કેન્દ્ર સરકાર ખેડૂતોનું દેવું માફ કરી દેવા માટે યોજના બનાવી રહી છે? ત્યારે તેના પર લેખિતમાં સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે દેવામાફીને લઈને હાલમાં સરકારની આવી કોઈ યોજના નથી તેવું જણાવવામાં આવ્યું હતું.

ક્લાસીફાઈડ / Classified

HIRING

Couple or 2 Students Required Full Time for Subway & Gas Station at Deep River, ON. Help will be Provided in PR Process Contact :-Ph. 613-852-1510

ગુજરાતમાં મહામારીથી 928 બાળકો અનાથ, 3,343એ પિતા ગુમાવ્યા

અમદાવાદ

કોવિડ-19 મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૯૨૮ બાળકો અનાથ થયા છે. જ્યારે આ મહામારીને કારણે ૩,૩૪૩ બાળકોને પિતાનું છત્ર ગુમાવવું પડ્યું છે. સરકારી સહાય માટે શરૂ થયેલા બાળ સ્વરાજ પોર્ટલ ઉપર ગુજરાતમાં અનાથ અને માતા અથવા પિતા બેઉમાંથી એક અર્થાત એક વાલી ગુમાવનાર શુન્યથી ૧૮ વર્ષ સુધીના ૪,૮૮૧ બાળકો નોંધાયા છે.

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના ટોચના અધિકારીએ કહ્યું કે, કોરોનાકાળના ૧૬ મહિનામાં ૯૨૮ અનાથ સહિત કુલ ૪,૮૮૧ બાળકોમાંથી ૬૨૦ની માતાના પણ અવસાન થયા છે. સરકારે કોવિડ-19ને કારણે અનાથ થયેલા બાળકો માટે ૧૮ વર્ષ સુધી મહિને રૂ.૪,૦૦૦ અને ત્યારબાદ ૨૧ વર્ષ સુધી મહિને રૂ.૬,૦૦૦ની સીધી સહાય ઉપરાંત શૈક્ષણિક અને પગભર થવા માટે અન્ય યોજનાઓ જાહેર કરી છે. જો કે, જાણકારીના અભાવે શરૂઆતમાં રજિસ્ટ્રેશન થતું નહોતું. હવે સમાજ કલ્યાણ અધિકારીઓ અને ગદ્યના સહયોગથી ૨૧ જુલાઈની સ્થિતિએ આ સંખ્યા ૪,૮૮૧એ પહોંચી છે. જેમાં સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં એકવાલી બાળકો નોંધાયા છે. અરવલ્લીમાં ૩૪૮, રાજકોટમાં ૩૪૨, ભાવનગરમાં ૩૦૬ બાળકોના માતા કે પિતાનું કોરોના કાળમાં મૃત્યુ થયું છે.

8 મહાનગરમાં રાત્રિ કફરૂંમાં 1 કલાકનો ઘટાડો, ગણેશોત્સવની થશે ઉજવણી

ગાંધીનગર

રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં કેસ નોંધાઈ રહ્યા છે. જેથી રાજ્ય સરકારે કેટલાક નિયમો હળવા કરી જનતાને રાહત આપી છે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કફરૂં યથાવત છે પરંતુ તેમા ઘટાડો કરવામા આવ્યો છે. ત્યાં જ આગામી સાર્વજનિક ગણેશોત્સવમાં કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કફરૂં અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. વધુમાં આગામી ગણેશોત્સવમાં 4 કૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.

2675 કરોડના ડ્રગ્સ સપ્લાયનો મુખ્ય આરોપી દિલ્હીથી પકડાયો

અમદાવાદ

175 કરોડનાં હેરોઈનના જથ્થાનો મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો છે. ગુજરાત ATSએ રૂ.175 કરોડના હેરોઈન કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરી લીધી છે. અગાઉ 500 કિલો હેરોઈન કેસમાં પણ આરોપી સાહિદ કાસમ સુમરા સંડોવાયેલો છે. NIAએ પંજાબથી 200 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું, જેમાં પણ તે માસ્ટરમાઈન્ડ હતો.

મળતી માહિતી પ્રમાણે, 175 કરોડના હેરોઈન કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. આ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સાહિદ

કાસમ સુમરા પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવાનું કામ કરતો હતો. આ આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દુબઈથી દિલ્હી આવવાનો છે અને બાતમીના આધારે એક ઓપરેશન હાથ ધર્યું હતું આરોપી સાહિદ કાસમ સુમરાની કુલ બે ગુનામાં સંડોવણી સામે આવી છે. અગાઉ 500 કિલો હેરોઈન કે જેની કુલ કિંમત 2500 કરોડ થાય છે તે ગુનામાં પણ સંડોવાયેલ હતો. સાહિદ કાસમ સુમરાએ મોકલેલા 500 કિલોમાંથી 200 કિલો ડ્રગ્સ NIAએ પંજાબ થઈ ઝડપ્યું હતું. સાહિદ કુલ 2675 કરોડના ડ્રગ્સ સપ્લાય કેસમાં સંડોવાયેલ હોવાનો ખુલાસો હાલ થયો છે.

પતિ પત્નીના રોજુંદા અંગત કૌટુંબિક જીવનમાં બાળકોનું સ્થાન

પતિ-પત્ની તથા કુટુંબના અન્ય સભ્યોના રોજુંદા કૌટુંબિક જીવનમાં કિલ્લોલ કરતાં તથા કાલીથેલી વાતો કરતાં ભુલકાઓ એટલે કે નાના બાળકોનું સ્થાન જગતની એક મહામુલી મુડી સમાન તથા જીવનને આનંદથી ભરપૂર કરી દેનાર પરમેશ્વર તરફની સુંદર ભેટ સમાન હોય છે.

આ નાના ભુલકાઓને એટલે કે નાના બાળકોને પતિ-પત્ની એટલે કે આ બાળકોના માતા-પિતા બહુ જ પ્રેમ કરે છે. તેમ છતાં પતિ પત્નીના અંગત કૌટુંબિક જીવનમાં આ નાના નાના ભુલકાઓ વિષે પતિ-પત્નીએ કઈ બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ તે વિષે અન્ય ધર્મોના ધર્મશાસ્ત્રોમાં કેવા આદેશો આપવામાં આવ્યા છે તે તો તે ધર્મોના ધર્મશાસ્ત્રોના ઝીણવટ ભર્યા અભ્યાસ કર્યા પછી જ જાણી શકાય છે.

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજહદમાં આ વિષે ખાસ બે બોધવચનો આપવામાં આવેલ છે, જેમાં પતિ-પત્નીના અંગત કૌટુંબિક જીવનની ચોક્કસ પળોમાં નાના બાળકો વિષે શી કાળજી રાખવી જોઈએ તે વિષેના આદેશો આપવામાં આવેલ છે. આ વિષેના કુરાન મજહદમાના બે બોધવચનો નીચે આપવામાં આવેલ છે.

“હે શ્રદ્ધાળુઓ (મોમીનો-ઈમાનવાળાઓ), એ જરૂરી છે કે તમારા દાસદાસીઓ અને તમારા એ બાળકો, જેઓ હજી પુખ્તવયના નથી થયેલ, ત્રણ સમયે તમારી પરવાનગી મેળવીને જ તમારી પાસે આવે. (આ ત્રણ સમય આ



મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજહદના બોધવચનો પર આધારિત

છે.) ફજર(પરોઢિયા)ની બંદગી નમાઝ પહેલાનો સમય, તથા બપોરના સમયે જ્યારે તમે આરામ કરવા માટે તમારા અમુક કપડા ઉતારી મુકો છો, તથા ઈશા (રાત્રિ)ની બંદગી-નમાઝ પછીના સમયે. આ ત્રણ સમય તમારા માટે પરદો કરવાના સમય છે. આ સિવાય તેઓ (બાળકો) વિના પરવાનગીએ આવે તો તમારા ઉપર કોઈ પાપ(ગુનાહ) નથી અને ન તેમની (બાળકો) ઉપર. તમારે એક બીજાની પાસે વારંવાર આવવાનું જ હોય છે. આ રીતે અલ્લાહ તમારા માટે પોતાના આદેશો સ્પષ્ટ કરે છે. અને

અલ્લાહ સર્વજ્ઞ અને ડહાપણ વાળો છે.” (પ્રકરણ ૨૪, શ્લોક ૫૮)

“અને જ્યારે તમારા બાળકો પુખ્ત વયે પહોંચી જાય, તો એ જરૂરી છે કે

ઈસ્લામની આરસી કાસિમ અબ્બાસ

તેઓ એવી જ રીતે પરવાનગી લઈને આવે, જેવી રીતે તેમના મોટા પરવાનગી લેતા આવ્યા છે. આવી રીતે અલ્લાહ પોતાના આદેશો તમારા માટે સ્પષ્ટ કરે

છે. અને અલ્લાહ સર્વજ્ઞ અને ડહાપણ વાળો છે.” (પ્રકરણ ૨૪, શ્લોક ૫૯)

ઉપર આપેલા કુરાન મજહદમાના બે બોધવચનો માંથી પહેલા બોધવચનનો સાર એ છે કે જ્યારે પતિ-પત્ની શયનખંડમાં એકલા હોય, તે સમયે-ખાસ કરીને પરોઢિયાના સમય પહેલા તથા બપોરના આરામના સમયે તથા મોડી રાત્રિના સમયે- તેમના નાના બાળકો, જેઓ હજી પુખ્ત વયના નથી થયેલ, તેઓ વગર પરવાનગીએ તેમના શયનખંડમાં ન આવે, એટલે કે પરવાનગી લઈને જ તેમના માતા-પિતા પાસે આવે.

ઉપર આપેલા બીજા બોધવચન અનુસાર બાળકો પુખ્ત વયે પહોંચી ગયા પછી પણ માતા-પિતાના શયનખંડમાં જવા માટે તેઓએ પરવાનગી લઈને જ પ્રવેશ કરવો જોઈએ. બંને બોધવચનોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ રીતે પાલનહાર અલ્લાહ સ્પષ્ટ આદેશો આપીને મનુષ્યોની દોરવણી કરે છે.

આ રીતે મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજહદમાં મનુષ્યના જગત જીવનની ઘણી બાબતો- ખાસ કરીને કૌટુંબિક બાબતો વિષે સચોટ દોરવણી આપતા અસંખ્ય આદેશો આપવામાં આવ્યા છે. આ બાબતોમાં લગ્ન સંબંધ, છુટાછેડા (તલાક), મનુષ્યના મૃત્યુ પછી તેણે પાછળ મુકેલ રોકડ રકમ તથા માલ-મિલ્કતના વારસાની ન્યાયસરની વહેંચણી, પુત્ર પુત્રીઓનો માતા પિતા સાથેનો વ્યવહાર, અન્ય સગાસંબંધીઓ સાથેનો વ્યવહાર, નિરાધારો અને દરિદ્રો સાથેનો વ્યવહાર વગેરે આ સર્વ બાબતોની સચોટ દોરવણી આપતા આદેશોનો સમાવેશ થાય છે.

ઉપસંહાર એ કે કુરાન મજહદમાના અન્ય તથા કૌટુંબિક બાબતો વિષેના આદેશોનું ચુસ્તપણે અનુસરણ કરનાર શ્રદ્ધાળુઓ(મોમીનો-ઈમાનવાળાઓ) નું જગત જીવન ખરેખર સુખી થઈ શકે છે. તે માટે શ્રદ્ધાળુઓ (મોમીનો-ઈમાનવાળાઓ)એ આ સર્વ આદેશોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જેથી તેમના બંને જીવન સફળ થાય.

દેશમાં બીજી લહેરમાં 33 લાખ લોકોનાં મોત થયા : સરવે

આઠ રાજ્યો-સાત શહેરોમાં જૂન 2020થી 2021 વચ્ચે નોંધાયેલા મોતના આધારે અભ્યાસ હાથ ધરાયો

નવી દિલ્હી

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં ૨૭થી ૩૩ લાખ લોકોના મોત થયા હોવાનું ટોરોન્ટો યુનિવર્સિટીના સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ રિસર્ચ અને ડાર્ટમાઉથ કોલેજમાં આર્થિક વિભાગના ડૉ. પૌલ નોવોસાદના એક અભ્યાસમાં જણાવાયું હતું. જોકે, કેન્દ્ર મુજબ કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક ૪.૨૧ લાખ છે. ભારતમાં જૂન ૨૦૨૦ અને જૂન ૨૦૨૧ વચ્ચે આઠ રાજ્યો અને સાત શહેરોમાં નોંધાયેલા મૃત્યુદરના આધારે આ અભ્યાસ હાથ ધરાયો હોવાનું જણાવાયું છે. વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીની પહેલી લહેર દરમિયાન સરેરાશ મૃત્યુદર ૨૨ ટકા વધુ હતો. આંધ્ર પ્રદેશમાં સરેરાશ મૃત્યુદર ૬૩ ટકા અને કેરળમાં ૬ ટકા હતો. આ વર્ષે એપ્રિલ અને જૂન વચ્ચે મહામારીની બીજી લહેર દરમિયાન સરેરાશ મૃત્યુદર ૪૬ ટકા હતો. જે મધ્ય પ્રદેશમાં ૧૮૮ ટકા સુધી પહોંચી ગયો હતો.

ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૪૩૫૦૯ લોકો સંક્રમિત થયા

ભારતમાં કોરોના કેસોની સંખ્યા સતત ૪૩ લાખથી ઉપર નોંધાઈ રહી છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક ફરીથી ૪ લાખથી ઉપર પહોંચી ગયો છે. રાહતની વાત એ છે કે દેશમાં કોવિડ રિકવરી રેટ ૯૭.૩૯ ટકા થઈ ગયો છે. ૨૪ કલાકમાં દેશમાં ૪૩,૫૦૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૫,૨૮,૧૧૪ થઈ ગઈ છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૭ લાખ ૧ હજાર ૬૧૨ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૮,૪૬૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૦૩,૮૪૦ એક્ટિવ કેસ છે.

કેરળમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત

કેરળમાં વધતા કેસના પગલે હવે સરકારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જ્યાં આખા દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં કેરળમાં સતત બે દિવસથી કોરોનાના ૨૨ હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે કેરળમાં છેલ્લા ૨ દિવસથી કોરોનાના દૈનિક કેસ ૨૨ હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે. જે દેશભરના દૈનિક કેસના ૫૦ ટકાથી વધુ છે. સતત વધી રહેલા કેસને પગલે હવે રાજ્ય સરકારે ૩૧ જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

આવતા મહિનાથી બાળકોને રસી અપાશે :મંત્રી

સરકાર બાળકોના રસીકરણનો કાર્યક્રમ આવતા મહિના સુધીમાં શરૂ કરે એવી શક્યતા છે. કેન્દ્રના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે યોજાયેલ ભાષ્ય સંસદીય પદ્ધતિ બેઠકમાં આમ જણાવીને ઉમેર્યું કે ભારત સૌથી મોટો રસી-ઉત્પાદક દેશ બનવાની દિશામાં છે. વધુ કંપનીઓને રસી ઉત્પાદન માટેનું લાયસન્સ મળશે.

કર્ણાટકના મુખ્યપ્રધાનનો તાજ લખનઉ-અયોધ્યા હાઈવે પર ટૂક અને અંતે બસવરાજ બોમ્મઈના શિરે બસ ટકરાતા 18ના મોત, 25 ઘાયલ

હેદરાબાદ

કર્ણાટકમાં આજથી નવા મુખ્યમંત્રી બસવરાજ એસ બોમ્મઈનું શાસન ચાલશે. બસવરાજ બોમ્મઈએ બુધવારે સવારે 11:00 કલાકે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. હાલ ફક્ત બોમ્મઈએ જ શપથ ગ્રહણ કર્યા છે મતલબ કે મંત્રીમંડળનો વિસ્તાર બાદમાં કરવામાં આવશે.

બોમ્મઈએ શપથ ગ્રહણ પહેલા પોતાના દિવસની શરૂઆત કેટલાક નેતાઓ સાથે બાલાબ્રુથી ગેસ્ટ હાઉસ પાસે અંજનેય મંદિરમાં જઈને કરી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા

હતા. તે સિવાય રાજભવનમાં પણ જ્યારે તેઓ શપથ ગ્રહણ કરવા માટે મંચ પર જઈ રહ્યા હતા ત્યારે તેમણે બી.એસ. યેદિયુરપ્પાના આશીર્વાદ લીધા હતા.

કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીએ બસવરાજ એસ બોમ્મઈને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. કેન્દ્રીય સુપરવાઈઝર્સની આગેવાનીમાં મંગળવારે બેંગલુરુ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં બોમ્મઈના નામ પર મહોર લાગી હતી.

લખનઉ

ઉત્તર પ્રદેશમાં એક બસની ટૂક સાથે ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમાં ૧૮ લોકો માર્યા ગયા હતા જ્યારે ૨૫ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત લખનઉ-અયોધ્યા હાઈવે પર થયો હતો. રાત્રે અહીંના કોટવાલી વિસ્તારમાં ૧૩૦ મુસાફરોથી સવાર ખાનગી બસની ટક્કર પાછળ આવી રહેલા ટૂક સાથે થઈ હતી. આ બસમાં ખામી સર્જાઈ હતી, જેને પગલે તેને રોડમાં બાજુમા જ પાર્ક કરી દેવામાં આવી હતી. એવામાં પાછળથી પુર ઝડપે આવી



રહેલા ટૂકે બસને અડકેટ લીધી હતી. જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે કેટલાક મુસાફરો બસની બાજુમાં તો કેટલાક બસની અંદર આરામ કરી

રહ્યા હતા. ૧૧ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા જ્યારે સાત લોકોને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે મોતને ભેટ્યા હતા.

અથડામણ બાદ મિઝોરમની યાત્રા ન કરવા સ્થાનિક લોકોને આસામ સરકારની અપીલ

સોમવારે થયેલી અથડામણમાં આસામ પોલીસના 6 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

દિસપુર

આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદની વચ્ચે, આસામની હિમંતા બિસ્વા સર્મા સરકારે તેમના રાજ્યના લોકોને મિઝોરમ નહીં જવા સૂચના આપી છે. આસામ સરકારે માર્ગદર્શિકા જારી કરીને કહ્યું છે કે આસામના લોકોને મિઝોરમની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આસામ સરકાર તેમની વ્યક્તિગત સલામતી માટે કોઈ ખતરો સ્વીકારશે નહીં. આસામ સરકારે આદેશમાં જણાવ્યું હતું કે આસામ



અને મિઝોરમના સરહદી વિસ્તારોમાં અથડામણના અનેક કેસ નોંધાયા છે. આ અથડામણો તાજેતરમાં કછાર, કરીમગંજ અને હૈલાકાંડીમાં જોવા મળી છે. તાજેતરમાં, 26 જુલાઈના રોજ,

કછારમાં થયેલી અથડામણમાં પોલીસ અને ત્યાંના નાગરિકો પર ફાયરિંગ થયું હતું. જેમાં આસામ પોલીસના 6 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે ઘણા નાગરિકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ બધા પછી પણ ઘણી મિઝો સિવિલ સોસાયટી, વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો અસમ રાજ્ય અને તેના લોકો વિશે સતત ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે. આસામ પોલીસ પાસે ઉપલબ્ધ વીડિયો ફૂટેજમાં આ સ્પષ્ટ જોઈ શકાય છે.

ઝારખંડના ધનબાદમાં ચોરીની રિક્ષાથી ટક્કર મારી જજની હત્યા

ધનબાદ

ઝારખંડના ઔદ્યોગિક શહેર ધનબાદ ખાતે બુધવારે સવારના સમયે ધનબાદના જજ ઉત્તમ આનંદનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વહેલી સવારે ૫:૦૦ કલાકે સંપૂર્ણપણે ખાલી રસ્તા પર તેઓ ડાબી બાજુ સાવ કિનારે ચાલી રહ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક રીક્ષા સીધી જવાના બદલે સહેજ ડાબી બાજુ વળી હતી અને તેમને ટક્કર મારીને ખૂબ જ ઝડપથી આગળ વધી ગઈ હતી. જ્યાં સુધી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે નહોતા આવ્યા ત્યાં સુધી લોકો તેને રોડ અકસ્માત કે દુર્ઘટના જ

માનતા હતા પરંતુ સીસીટીવી વીડિયો સામે આવ્યા બાદ તે હત્યાનું ધડયંત્ર હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને સ્પષ્ટ જણાય છે કે, જજ ઉત્તમ આનંદને જાણી જોઈને રીક્ષા વડે ટક્કર મારવામાં આવી હતી.

આ કેસમાં ધનબાદ પાસેની ગિરિડીહ પોલીસને ભારે મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં રીક્ષાચાલક અને તેના બે સહયોગીઓની ગિરિડીહ ખાતેથી ધરપકડ કરી છે. બંને જોડાપોખર થાણા ક્ષેત્રના ડિગવાડીહ ૧૨ નંબરના રહેવાસી છે.

યુપીમાં શરદ પવારની ઍન્ટ્રી, અખિલેશ યાદવ સાથે મળીને લડશે ચૂંટણી

લખનઉ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીઓ માટે રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે. દરેક પક્ષ પોતાના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત છે આ પ્રકારના સંજોગોમાં હવે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારની યુપીના રાજકારણમાં ઍન્ટ્રી થઈ છે. યુપીમાં આ વખતે એનસીપી પણ ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ માટે એનસીપી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણ થવાની શક્યતાઓ છે. એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ કે કે શર્માએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, યુપીમાં અમારી પાર્ટી ચૂંટણી લડશે અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ભાજપને હરાવશે.

સરહદ વિવાદ : ભારતે હાસીમારામાં રાફેલ ફાઈટર વિમાન તૈનાત કર્યા

નવી દિલ્હી

ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારતે મોટું પગલું ભર્યું છે. ભારતીય વાયુસેનાએ પૂર્વ વાયુ કમાન્ડ હેઠળ હાસીમારાના વાયુસેના સ્ટેશનમાં રાફેલ વિમાનને પોતાની ૧૦૧ સ્કવોડ્રનમાં સામેલ કર્યા. પશ્ચિમ બંગાળમાં હાસીમારા પાસે પહેલા મિગ ૨૭ સ્કવોડ્રન હતી. જેને હવે સેવામુક્ત કરાઈ છે. તે ભૂટાન સાથે નિકટતાના કારણે વાયુસેનાના સંચાલન માટે એક રણનીતિક આધાર છે. ચુંબી ઘાટી, જ્યાં ભારત, ભૂટાન અને ચીન વચ્ચે એક

ત્રિકોણીય જંકશન છે ડોકલામ નજીક છે, જ્યાં ૨૦૧૭માં ગતિરોધ થયો હતો. ત્રણેય દેશો માટે ત્રિકોણીય જંકશન ચિંતાનો વિષય રહ્યો છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયાએ કહ્યું કે પૂર્વ ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની ક્ષમતાને મજબૂત કરવાના મહત્વને ધ્યાનમાં રાખતા હાસીમારામાં રાફેલને સામેલ કરવાની સાવધાનીપૂર્વક યોજના બનાવવામાં આવી છે. તેઓ ક્ષેત્રમાં ચીનથી જોખમ વિશે વાત કરી રહ્યા હતા. ભારત અને ચીન છેલ્લા દોઢ વર્ષથી સરહદ વિવાદમાં ગૂંચવાયેલા છે.

ગુજ. કેડરના IPS રાકેશ અસ્થાના દિલ્હી પોલીસના નવા કમિશનર બનશે

નવી દિલ્હી

દિલ્હી પોલીસને નવા કમિશનર મળી ગયા છે. 1984 બેચના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી, રાકેશ અસ્થાના, દિલ્હી પોલીસના નવા કમિશનર બનશે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. ગૃહ મંત્રાલયે રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવા અંગેનો આદેશ જારી કર્યો છે. અસ્થાના હાલમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ડાયરેક્ટર જનરલ (ડીજી) તરીકે ફરજ બજાવે છે. રાકેશ અસ્થાના હાલમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ડાયરેક્ટર જનરલ (ડીજી) તરીકે તેનાત છે.

**Dr. Salim Kapadia** DDS

Dental Centre

Your Perfect
Smile...Is Our Greatest
Satisfaction!**SERVICES**

- Smile Makeover
- Laser Teeth Whitening
- Dental Implants - Start to Finish
- Single Visit Root Canal
- Re-treatment of Failing Root Canal
- Surgical Wisdom Teeth Extraction
- Scaling & Root Planing
- White Tooth Colored Filling
- Implant Retained Dentures
- Complete & Partial Dentures
- Lumineers & Veneers
- Crown & Bridges (Zirconia & E.max)

1825 Markham Rd, Suite 102
Scarborough, ON M1B 4Z9
drsalmikapadiadental.com

416-321-3268

We have a plan to
build back better by
investing in:

- ◆ National Childcare
- ◆ Affordable Housing
- ◆ Workers and small business

Salma Zahid
Member of Parliament
for Scarborough Centre

SCARBOROUGH

5-2155 Lawrence Avenue East
Scarborough, ON M1R 5G9

Tel. (416) 752-2358, Fax (416) 752-4624